



ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ
(ગુજરાત સરકારનું ઉપક્રમ)

CIN:U02005GJ1976SGC002927

માહિતી અધિકાર અધિનિયમ-૨૦૦૫ની

કલમ-૪(૧)(ખ) હેઠળ તા.૦૧-૦૫-૨૦૨૩ના રોજની
સ્થિતિએ પ્રો-એક્ટીવ ડીસ્ક્લોઝર કરવા બાબત.

'વનગંગા, ૭૮, અલકાપુરી, વડોદરા-૩૯૦૦૦૭

અનુક્રમણિકા

પ્રકરણ	વિગત	પાન ક્રમાંક
૧.	પ્રસ્તાવના	૩
૨.	નિગમનું વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજો	૬
૩.	નિગમના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો	૯
૪.	દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતિ	૧૭
૫.	કાર્યો કરવા માટે નિગમે નક્કી કરેલા ધોરણો	૨૦
૬.	કાર્યો કરવા માટેના નિયમો, વિનિયમો, સૂચનાઓ, નિયમસંગ્રહો અને દફતરો	૨૧
૭.	નિગમની પાસે અથવા તેના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક	૨૨
૮.	નિગમની નીતિ ઘડતરના અથવા તેના અમલીકરણના સંબંધમાં જનતાના સભ્યો સાથે વિચારવિનિમય માટે અથવા તેમના દ્વારા રજુઆત માટેની વિદ્યમાન કોઈ ગોઠવણની વિગતો	૨૩
૯.	નિગમના ભાગ તરીકે રચાયેલ બોર્ડ, પરિષદ, સમિતિઓ અને અન્ય સંસ્થાઓનું પત્રક	૨૪
૧૦.	નિગમના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતિ પુસ્તિકા (ડીરેક્ટરી)	૨૫
૧૧.	નિગમના વિનિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પદ્ધતિ સહિત તેના દરેક અધિકારી અને કર્મચારીને મળતું માસિક મહેનતાણું	૩૪
૧૨.	નિગમને ફાળવવામાં આવેલ અંદાજપત્ર	૩૮
૧૩.	સહાયકી કાર્યક્રમોના અમલ અંગેની પદ્ધતિ	૩૯
૧૪.	નિગમે આપેલ છૂટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારની વિગતો	૪૧
૧૫.	વિજાણુરૂપે ઉપલબ્ધ માહિતિ	૪૨
૧૬.	માહિતિ મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓ	૪૩
૧૭.	જાહેર માહિતિ અધિકારીઓનાં નામો, હોદ્દાઓ અને બીજી વિગતો	૪૪
૧૮.	અન્ય ઉપયોગી માહિતિ	૪૬

પ્રકરણ—૧

પ્રસ્તાવના

૧.૧ આ પુસ્તિકાની પશ્ચાદભૂમિકા અંગે જાણકારી :

પ્રત્યેક જાહેર સત્તામંડળના કામકાજમાં પારદર્શિતા અને જવાબદારીને ઉત્તેજન આપવાના હેતુથી જાહેર સત્તામંડળોના નિયંત્રણ હેઠળની માહિતી નાગરિકો મેળવી શકે તેવા માહિતીના અધિકારના વ્યવહારુ તંત્રની રચના કરવા અને તેની સાથે સંકળાયેલી અથવા તેને આનુષંગિક બાબતો માટેની જોગવાઈ કરવા બાબત માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ અમલમાં આવેલ છે જેની એક જોગવાઈ હેઠળ દરેક સત્તામંડળ દ્વારા આ પુસ્તિકા પ્રકાશિત કરવાનું ફરજિયાત ઠરાવવામાં આવેલ છે. તેના અનુસંધાને નિગમ દ્વારા આ પુસ્તિકા પ્રકાશિત કરવામાં આવે છે.

૧.૨ આ પુસ્તિકાનો ઉદ્દેશ / હેતુ

લોકશાહીમાં નાગરિકો જાહેર સત્તામંડળોની કામગીરીથી માહિતગાર રહે અને કામગીરી અંગેની માહિતી પારદર્શિત રહે તે જરૂરી છે. વધુમાં જાહેર સત્તામંડળો પ્રજાને જવાબદાર રહે તે પણ જરૂરી છે.

ખરેખર વ્યવહારમાં માહિતીને જાહેર કરવાથી જાહેર સત્તામંડળના કાર્યક્ષમ સંચાલન, મર્યાદિત નાણાંકીય સાધનોનો મહત્તમ ઉપયોગ અને સંવેદનશીલ માહિતીની ગોપનીયતાની જાળવણી સહિતના બીજા જાહેર હિતો સાથે સંઘર્ષ થાય તેમ છે. આથી લોકશાહી આદર્શની સર્વોપરિતા જાળવતી વખતે આ સંઘર્ષમયી હિતો વચ્ચે સંવાદિતા સાધવી પણ તેટલી જ જરૂરી છે.

તેથી જે નાગરિકો નિગમ અંગે માહિતી મેળવવા માંગતા હોય તેમને અમુક માહિતી પૂરી પાડવાના ઉદ્દેશથી આ પુસ્તિકાનું પ્રકાશન કરવામાં આવેલ છે.

૧.૩ આ પુસ્તિકા કઈ વ્યક્તિઓ/સંસ્થાઓ/સંગઠનો વગેરેને ઉપયોગી છે?

આ પુસ્તિકા નાગરિકો, નિગમ સાથે ધંધાકીય વ્યવહારો કરતા પક્ષો, બિનસરકારી સંગઠનો તથા સરકારી વિભાગોને ઉપયોગી છે.

૧.૪ આ પુસ્તિકામાં આપેલી માહિતીનું માળખું :

આ પુસ્તિકામાં આવરી લેવામાં આવેલ માહિતી કે માહિતીના સંદર્ભો પુસ્તિકામાં સમાવિષ્ટ માહિતી કે અન્ય રેકર્ડ, દસ્તાવેજો, પરિપત્રો, હુકમો, અહેવાલો, કાગળો વિ. ના સ્વરૂપમાં અથવા કોઈ ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં રહેશે.

૧.૫ વ્યાખ્યાઓ :

- (૧) આ પુસ્તિકામાં, સંદર્ભથી અન્યથા અપેક્ષિત ન હોય તો,
 - (ક) "અધિનિયમ" એટલે માહિતીનો અધિકાર અધિનિયમ, ૨૦૦૫ (ભારત સરકાર, ૨૦૦૫ નો ૨૨ મો અધિનિયમ)
 - (ખ) "અપીલ સત્તાધિકારી" એટલે

- (૧) કોઈપણ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલ માહિતી માંગતી અરજના પ્રતિભાવરૂપે જાહેર માહિતી અધિકારી કે મદદનીશ જાહેર માહિતી અધિકારીએ આપેલ નિર્ણયથી નારાજ થયેલ અરજદાર વ્યક્તિ જેને પ્રથમ અપીલ કરી શકે તે સત્તાધિકારી એટલે કે નિગમના મેનેજીંગ ડાયરેક્ટરશ્રી ;
- (૨) ઉક્ત (૧) માં કરેલ અપીલના પ્રતિભાવરૂપે પ્રથમ અપીલ સત્તાધિકારીએ એટલે કે મેનેજીંગ ડાયરેક્ટરે આપેલ નિર્ણયથી નારાજ થયેલ વ્યક્તિ જેને દ્વિતીય અપીલ કરી શકે તે સત્તાધિકારી એટલે કે રાજ્ય માહિતી પંચ.
- (ગ) **"જાહેર માહિતી અધિકારી"** એટલે નિગમ દ્વારા અધિનિયમની કલમ ૫ ની પેટા કલમ (૧) હેઠળ જાહેર માહિતી અધિકારી તરીકે મુકરર કરવામાં આવેલ અધિકારી અને તેમાં પેટા કલમ (૨) હેઠળ મદદનીશ જાહેર માહિતી અધિકારી તરીકે મુકરર કરવામાં આવેલ અધિકારીનો પણ સમાવેશ થાય છે.
- (ઘ) **"નિગમ"** એટલે ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ.
- (ચ) **"માહિતી"** એટલે નિગમના વહીવટ, સંચાલન કે નિર્ણયને લગતા રેકર્ડ, દસ્તાવેજો, મેમો, ઈ-મેઈલ, અભિપ્રાયો, સૂચના, અખબારી-યાદી, પરિપત્રો, હુકમો, લોગબુક, કરારો, અહેવાલો, કાગળો, નમુના, મોડલ્સ, કોઈ ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં માહિતી-સામગ્રી અને તત્સમયે અમલમાં હોય તેવા કોઈ કાયદા હેઠળ નિગમ મેળવી શકે તેવી કોઈ ખાનગી મંડળને લગતી માહિતી સહિતની કોઈપણ સ્વરૂપમાં કોઈપણ સામગ્રી.
- (છ) **"માહિતીનો અધિકાર"** એટલે આ અધિનિયમ હેઠળ નિગમ પાસેની અથવા તેના નિયંત્રણ હેઠળની માહિતી મેળવવાનો અધિકાર અને તેમાં—
- (૧) કામકાજ, દસ્તાવેજો, રેકર્ડની તપાસ કરવાના;
- (૨) દસ્તાવેજો અથવા રેકર્ડની નોંધ, ઊતારા અથવા પ્રમાણિત નકલો લેવાના;
- (૩) સામગ્રીના પ્રમાણિત પુરાવા લેવાના;
- (૪) ડિસ્કેટ્સ, ફ્લોપી, ટેપ, વિડિયો કેસેટના સ્વરૂપમાં અથવા બીજી કોઈ ઈલેક્ટ્રોનિક પધ્ધતિમાં અથવા જ્યારે આવી માહિતી કોઈ કોમ્પ્યુટરમાં અથવા બીજા કોઈ સાધનમાં સંગ્રહિત હોય ત્યારે પ્રિન્ટ આઉટની મારફતે મેળવવાના; અધિકારનો સમાવેશ થાય છે.
- (જ) **"રેકર્ડ"** એટલે
- (૧) કોઈ દસ્તાવેજ, હસ્તપ્રત તથા ફાઈલ ;
- (૨) કોઈ દસ્તાવેજની માઈક્રોફિલ્મ, માઈક્રોફીશ અથવા ફેસીમાઈલ નકલ
- (૩) આવી માઈક્રોફિલ્મમાં સમાવિષ્ટ પ્રતિકૃતિ અથવા પ્રતિકૃતિઓની (મોટી કરેલી હોય કે ન હોય તો પણ) કોઈ નકલ ; અને
- (૪) કોમ્પ્યુટર અથવા બીજા કોઈ સાધનથી રજૂ કરેલી બીજી કોઈ સામગ્રી.
- (ઝ) **"રાજ્ય માહિતી પંચ"** એટલે અધિનિયમની કલમ-૧૫ ની પેટા-કલમ (૧) હેઠળ રચાયેલું રાજ્ય માહિતી પંચ.
- (૨) આ પુસ્તિકામાં વ્યાખ્યાયિત ન કરાયેલા શબ્દો અને શબ્દપ્રયોગોનો અર્થ અધિનિયમમાં વ્યાખ્યાયિત કર્યા મુજબ થશે.

૧.૬ કોઈ વ્યક્તિ આ પુસ્તિકામાં આવરી લેવાયેલ વિષયો અંગે વધુ માહિતી મેળવવા માંગે તો તે માટેની સંપર્ક વ્યક્તિ:

કોઈ વ્યક્તિ આ પુસ્તિકામાં આવરી લેવાયેલ વિષયો અંગે વધુ માહિતી મેળવવા માંગે તો તે માટેની સંપર્ક વ્યક્તિ મદદનીશ જાહેર માહિતી અધિકારી અથવા જાહેર માહિતી અધિકારી રહેશે.

૧.૭ આ પુસ્તિકામાં ઉપલબ્ધ ન હોય તે માહિતી મેળવવા માટેની કાર્યપદ્ધતિ અને ફી :

આ પુસ્તિકામાં ઉપલબ્ધ ન હોય તે માહિતી મેળવવા ઈચ્છતી વ્યક્તિએ જે બાબત માટે માહિતી મેળવવાની હોય તેની વિગતો દર્શાવતી અરજી આ પુસ્તિકાના પ્રકરણ-૧૮ માં દર્શાવેલ નમૂનામાં તેમજ તેમાં નિયત કરવામાં આવેલ ફી ચૂકવીને જાહેર માહિતી અધિકારીને લેખિતમાં અથવા વિજાણુ માધ્યમો દ્વારા કરવી.

પ્રકરણ-૨ નિગમનું વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજો

૨.૧ નિગમનો ઉદ્દેશ / હેતુ :

નિગમના મુખ્ય ઉદ્દેશો નીચે મુજબ છે.

- (ક) રાજ્યમાં પ્રાપ્ત થતી ગૌણ વન પેદાશોના સઘન ઉપયોગ અને વિકાસ અર્થે પ્રયત્ન કરવો જેથી વનોમાંથી એકત્ર થતી કોઈપણ પેદાશો નિરર્થક ન જાય.
- (ખ) વિકાસશીલ કાર્યક્રમો દ્વારા ગૌણ વન પેદાશોની ગુણવત્તા તથા જથ્થામાં વધારો કરવો જેમાં આદિવાસીઓને પ્રશિક્ષણ આપવાના કાર્યક્રમનો પણ સમાવેશ થાય છે.
- (ગ) વન ઉપજ આધારિત વ્યાપારને પ્રોત્સાહિત કરવા આદિવાસી વિસ્તારમાં કુટીર તથા મોટા પાયાના ઉદ્યોગો હાથ ધરવા જેથી આદિવાસીઓને ઉચિત રોજગારી મળે તથા તેઓનું આર્થિક ઉત્થાન થાય.
- (ઘ) આદિવાસી પ્રજાનું શોષણ અટકાવવા માટે મધ્યસ્થી પ્રથાને નાબુદ કરવી.
- (ચ) વન પેદાશોના અંતિમ ઉપભોક્તાઓને ચોખ્ખી ગૌણ વન પેદાશો કિફાયત ભાવથી ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા કરવી.
- (છ) સંસ્થાકીય નાણાંની મદદથી સર્વોચ્ચ વિકાસ સાધવો.

૨.૨ નિગમનું મિશન, દુરંદેશીપણું (વિઝન) :

રાજ્યમાં ગૌણ વન પેદાશો એકત્ર કરતા આદિવાસીઓનું ખાનગી વ્યાપાર દ્વારા થતું શોષણ નાબુદ કરવું અને વનવાસીઓનું આર્થિક ઉત્થાન કરીને રાજ્યની બહુમૂલ્ય ગૌણ વન પેદાશો તથા વનસંપદાનો સાતત્યપૂર્ણ સંચાલન સાથે વિકાસ કરવો એ નિગમનું મિશન છે.

વનવાસીઓના હિતાર્થે તથા તેમના સર્વોચ્ચ વિકાસાર્થે અગ્રેસર રહી તેમના આર્થિક હિતોનું રક્ષણ કરતા નિગમ તરીકે રાજ્યમાં એક આગવી પ્રતિષ્ઠા અને ઓળખ ઉભી કરવી એ નિગમનું વિઝન છે.

૨.૩ નિગમનો ટૂંકો ઈતિહાસ અને તેની રચનાનો સંદર્ભ :

રાષ્ટ્રીય કૃષિ પંચની ભલામણોના આધારે રાજ્ય સરકાર દ્વારા ૧૯૭૬ માં નિગમની સ્થાપના કરવામાં આવેલ. સરકારશ્રીના તત્કાલિન કૃષિ, વન તથા સહકાર વિભાગના તારીખ : ૨૧-૭-૧૯૭૬ ના ઠરાવ ક્રમાંક : ટીઆરએસ-૧૦૭૬/૭૫૧૫૫-પી હેઠળ નિગમની રચના કરવામાં આવેલ તથા કંપની ધારા, ૧૯૫૬ હેઠળ એક કંપની સ્વરૂપે નોંધણી ક્રમાંક : ૨૯૨૭/૧૯૭૬ હેઠળ નિગમ અસ્તિત્વમાં આવેલ.

નિગમ ભારતના બંધારણના અનુચ્છેદ ૧૯(૬)(૨) હેઠળ વાજબીપણું ધરાવતા એક સામાજિક સેવાક્ષેત્રના નિગમનો દરજ્જો ધરાવે છે.

૨.૪ નિગમની ફરજો :

- (ક) રાજ્યમાં પ્રાપ્ત થતી ગૌણ વન પેદાશોના સઘન ઉપયોગ અને વિકાસ અર્થે પ્રયત્ન કરવો.
- (ખ) વિકાસશીલ કાર્યક્રમો દ્વારા ગૌણ વન પેદાશોની ગુણવત્તા તથા જથ્થામાં વધારો કરવો.
- (ગ) આદિવાસી વિસ્તારમાં કુટીર તથા મોટા પાયાના ઉદ્યોગો હાથ ધરવા.
- (ઘ) મધ્યસ્થી પ્રથાને નાબુદ કરીને આદિવાસી પ્રજાનું શોષણ અટકાવવું.
- (ચ) વન પેદાશોના અંતિમ ઉપભોક્તાઓને ચોખ્ખી ગૌણ વન પેદાશો કિફાયત ભાવથી ઉપલબ્ધ કરાવવી.

૨.૫ નિગમની મુખ્ય પ્રવૃત્તિઓ / કાર્યો :

- (ક) ગૌણ વન પેદાશોનું એકત્રીકરણ, પ્રક્રિયા તથા વેચાણ.
- (ખ) વાંસદા (જી.નવસારી) ના અંતરિયાળ વિસ્તારમાં આશરે ૧૨૫ આદિવાસીઓને રોજગારી પૂરી પાડતા "વનિલ ઉદ્યોગ" નામના સંકલિત લક્કડકામ એકમમાં સાગી-બિનસાગી બારી-બારણા, ફર્નિચર અને સ્કુલ બેન્ચનું ઉત્પાદન તથા વેચાણ.
- (ગ) "ધન્વંતરી" બ્રાન્ડ હેઠળ મધ તથા આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન તથા વેચાણ.
- (ઘ) સંસ્થાકીય નાણાંની સહાયથી પાનમ વનોનો સઘન વનીકરણ દ્વારા વિકાસ.

૨.૬ ટીમરૂપાનના યુનિટ/ફંડ

ટીમરૂપાનની જે તે વિસ્તારમાં ઉપલબ્ધતા, વૃક્ષોની સંખ્યા, વિસ્તાર મુજબ સંચાલન માટે જીલ્લાવાર ટીમરૂ એકમોની રચના કરવામાં આવી છે. ગુજરાત રાજ્યમાં અનુસુચિત તેમજ બિન અનુસુચિત વિસ્તારના જીલ્લાઓમાં ૧૦૮ તથા અભ્યારણ્ય વિસ્તારના ૧૫ ટીમરૂ એકમોની રચના કરવામાં આવેલ છે. ટીમરૂપાન એકત્રીકરણ, સંગ્રહણની સીઝન એપ્રિલ-મે-જુન મહિનામાં હોય છે. ટીમરૂપાનના એકત્રીકરણના સ્થળને ફંડ તરીકે ઓળખાય છે. ગામ લોકો ટીમરૂપાન એકત્ર કરી ફંડ ઉપર લાવે છે. ફંડ ઉપર મેનેજમેન્ટની કામગીરી કરતા વ્યક્તિને ફંડમુશી તરીકે ઓળખાય છે. ટીમરૂપાનના ૪૫ થી ૫૫ પાનનો ૧ પુડો હોય છે. આવા ૧૦૦૦ પુડાનો એક સ્ટાન્ડર્ડ બેગ તરીકે ઓળખવામાં આવે છે. સીઝન-૨૦૨૩ માટે સ્ટાન્ડર્ડ બોરા દીઠ ભાવ (૧૦૦૦ પુડા માટે) રૂ. ૧૩૦૦/- નિયત કરવામાં આવેલ હતો.

2.7 નિગમના સંસ્થાગત માળખાનો આલેખ



પ્રકરણ-૩

નિગમના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

૧. મેનેજીંગ ડાયરેક્ટર :

સત્તાઓ : નિગમની કાર્યવાહી સુવ્યસ્થિત ચાલે તે માટે પૂર્ણ સમયના ડાયરેક્ટર તરીકે મેનેજીંગ ડાયરેક્ટરશ્રીની નિગમમાં નિમણુંક કરવામાં આવે છે અને તે રીતે તેઓ ડાયરેક્ટર મંડળના પ્રતિનિધિ તરીકે મંડળના નિયંત્રણ અને દેખરેખ હેઠળ કામગીરી બજાવે છે. આમ મેનેજીંગ ડાયરેક્ટરશ્રી નિગમના મુખ્ય કાર્યકારી અધિકારી છે. નિગમના રોજબરોજના સંચાલન માટે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તેમને વિશાળ સત્તાઓ સોંપેલ છે અને તે સત્તાઓનો ઉપયોગ કરીને તેઓ નિગમનું સંચાલન કરે છે.

ફરજો : નિગમના કુશળ સંચાલનની જવાબદારી મેનેજીંગ ડાયરેક્ટરશ્રીને સોંપવામાં આવેલ છે અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના એકંદર નિયંત્રણ, દેખરેખ અને નિર્દેશન પ્રમાણે મેનેજીંગ ડાયરેક્ટરશ્રી તેમની ફરજ બજાવે છે.

૨. જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટર :

સત્તાઓ : (૧) તાબા હેઠળના અધિકારીઓને યોગ્ય આદેશ આપવા.
(૨) તાબા હેઠળના કર્મચારીઓની પરચુરણ રજા તથા વળતર રજા મંજૂર કરવી.

ફરજો: (૧) નિગમના ધન્વન્તરી એકમ તથા વનિલ ઉદ્યોગને સ્પર્શતી તમામ બાબતો પર નિયંત્રણ.
(૨) ગૌણ વન પેદાશ, પ્લાન્ટેશન્સ તથા ચારકોલની સમગ્ર કામગીરી પર નિયંત્રણ.
(૩) ડીવીઝનની ક્ષેત્રીય કામગીરી અને ધન્વન્તરી એકમ તથા વનિલ ઉદ્યોગની કામગીરીનું ફેરણું, નિરીક્ષણ તથા તાંત્રિક સૂચનાઓ આપવી.
(૪) તકેદારી તથા માર્કેટીંગ વિભાગ પર નિયંત્રણ.
(૫) મેનેજીંગ ડાયરેક્ટરશ્રીની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે કામગીરી કરવી.

૩. કંપની સચિવ કમ સીનીયર મેનેજર (લીગલ એન્ડ પર્સોનેલ)

સત્તાઓ : (૧) કંપની ધારા, ૨૦૧૩ ની જોગવાઈઓ પ્રમાણે જરૂરી પત્રકો સહી કરી રજીસ્ટ્રાર ઓફ કંપનીઝમાં ફાઈલ કરવા.

(૨) તાબા હેઠળના કર્મચારીઓને જરૂરી સૂચના આપવી.

(૩) તાબા હેઠળના કર્મચારીઓની પરચુરણ રજા તથા વળતર રજા મંજૂર કરવી.

ફરજો : (૧) કંપની ધારા, ૨૦૧૩ ની જોગવાઈઓ પ્રમાણે નિગમને સ્પર્શતી જરૂરી કાર્યવાહી કરવી.

- (૨) ડાયરેક્ટર તથા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ ને લગતી જરૂરી કાર્યવાહી કરવી.
- (૩) કોર્ટ કેસને લગતી કામગીરી.
- (૪) અગત્યની પર્સોનેલ બાબતોમાં સલાહસૂચન આપવું.
- (૫) મેનેજીંગ ડાયરેક્ટરશ્રીની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે કામગીરી કરવી.

૪. સી.ની. મેનેજર(એમએફપી) :

- સત્તાઓ :**
- (૧) ડીવીઝનલ મેનેજરોને તેમની કામગીરી અંગે યોગ્ય આદેશ આપવા.
 - (૨) ડીવીઝનલ મેનેજરોના પ્રવાસ કાર્યક્રમ મંજૂર કરવા.
 - (૩) તાબા હેઠળના કર્મચારીઓને જરૂરી સૂચના આપવી.
 - (૪) તાબા હેઠળના કર્મચારીઓની પરચુરણ રજા તથા વળતર રજા મંજૂર કરવી.

- ફરજો:**
- (૧) ગૌણ વન પેદાશોની કામગીરી પર દેખરેખ.
 - (૨) બાંધકામની કામગીરી પર નિયંત્રણ.
 - (૩) નિગમની જરૂરિયાતની તમામ સાધન સામગ્રી તથા વાહનોની ખરીદીની કામગીરી.
 - (૪) નિગમના વાહનોના રીપેરીંગ, રદબાતલ તથા તેના નિકાલની કાર્યવાહી.
 - (૫) મેનેજીંગ ડાયરેક્ટરશ્રીની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે કામગીરી કરવી.
 - (૬) ચારકોલનું ઉત્પાદન તથા વેચાણની કામગીરી પર દેખરેખ.

૫. ડીવીઝનલ મેનેજર (એમએસપી ફોર એમએફપી) :

- ફરજો :**
- (૧) ટ્રાઈફેડ, આદિજાતિ વિભાગ, નેશનલ આયુષ મિશન, તેમજ સ્ટેટ મેડીસીનલ પ્લાન્ટસ બોર્ડ હેઠળની યોજનાઓના એકત્રીકરણની વહીવટી કામગીરી.
 - (૨) ગૌણ વન પેદાશોના ટેકાના ભાવે ખરીદી કરવા બાબતની તમામ પ્રકારની વહીવટી કામગીરી.

૬. સબ ડીવી. મેનેજર, ગાંધીનગર

- સત્તાઓ :**
- (૧) ગાંધીનગર કચેરીના પરચુરણ ખર્ચ તથા સ્ટાફના પેમેન્ટ મંજૂર કરી ચુકવણું કરવું.
 - (૨) તાબા હેઠળના કર્મચારીઓને જરૂરી સૂચના આપવી.
 - (૩) તાબા હેઠળના કર્મચારીઓની પરચુરણ રજા તથા વળતર રજા મંજૂર કરવી.

- ફરજો :**
- (૧) ગાંધીનગર ખાતે વન અને પર્યાવરણ વિભાગ તથા અન્ય સરકારી વિભાગો સાથે નિગમની વિવિધ દરખાસ્તો અંગે જરૂરી લાપેઝનની કામગીરી.
 - (૨) મેનેજીંગ ડાયરેક્ટરશ્રીની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે કામગીરી કરવી.

૭. સી.ની. મેનેજર (માર્કેટીંગ) :

સત્તાઓ : (૧) તાબા હેઠળના કર્મચારીઓને જરૂરી સૂચના આપવી.

(૨) તાબા હેઠળના કર્મચારીઓની પરચુરણ રજા તથા વળતર રજા મંજૂર કરવી.

ફરજો: (૧) નિગમના ઉત્પાદનોના વેચાણ વધે તે માટે વેપારીઓ / વ્યાપારી સંસ્થાઓનો સંપર્ક કરવો તથા બહોળા વેચાણ માટે પ્રયત્ન કરવો.

(૨) નિગમના વેચાણ કેન્દ્રો ઉપર ઉત્પાદિત ચીજ વસ્તુઓનો જથ્થો જળવાઈ રહે તથા વેપારી સંસ્થાઓ, વેપારીઓને માગણી મુજબનો નિગમ ઉત્પાદિત જથ્થો સમયસર મળી રહે તે જોવું.

(૩) નિગમના ઉત્પાદનોના વેચાણ માટે વિવિધ માધ્યમો મારફત પ્રસિધ્ધિ કરવી તથા જાહેર ઉત્સવો, મેળા વગેરેમાં નિગમના ઉત્પાદનોના સ્ટોલ રાખી વેચાણ વધે તે મુજબની કામગીરી હાથ ધરવી.

(૪) મેનેજીંગ ડાયરેક્ટરશ્રીની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે કામગીરી કરવી.

(૫) નિશ્ચિત નાણાકીય મર્યાદા સુધીની ચીજવસ્તુઓની ખરીદી અને વાહન તથા મશીનરી મરામત કરાવવી.

(૬) તાબા હેઠળના કર્મચારીઓને જરૂરી સૂચના આપવી.

(૭) તાબા હેઠળના કર્મચારીઓની પરચુરણ રજા તથા વળતર રજા મંજૂર કરવી.

૮. વર્કસ મેનેજર :

સત્તાઓ : (૧) નિશ્ચિત નાણાકીય મર્યાદા સુધીની ચીજવસ્તુઓની ખરીદી અને વાહન તથા મશીનરી મરામત કરાવવી.

(૨) તાબા હેઠળના કર્મચારીઓને જરૂરી સૂચના આપવી.

(૩) તાબા હેઠળના કર્મચારીઓની પરચુરણ રજા તથા વળતર રજા મંજૂર કરવી.

ફરજો: (૧) હિસાબી તથા વહીવટી કામગીરી પર અને પ્લાનીંગ, ઉત્પાદન તથા વેચાણની તમામ કામગીરી પર નિરીક્ષણ કરવું તેમજ માર્ગદર્શન આપવું.

(૨) જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટરશ્રીની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે કામગીરી કરવી.

૯. નાણાકીય અંકુશક :

સત્તાઓ : (૧) મુખ્ય કચેરીના બેંક એકાઉન્ટ ઓપરેટ કરવા.

- (૨) ટેક્ષ, ડીપોઝીટ રીફંડ, કન્ટીન્જન્સી તથા પગાર ભથ્થા વિ. ના ખર્ચના બીલ મંજૂર કરી ચૂકવણું કરવું.
- (૩) નિગમના કર્મચારીઓને ઓફીસ એડવાન્સ, સાયકલ એડવાન્સ, પંખા એડવાન્સ, અનાજ ખરીદી એડવાન્સ, મકાન બાંધકામ / ખરીદ પેશગી વગેરે મંજૂર કરવા.
- (૪) બેંકમાં ફીક્સ ડીપોઝીટ મૂકવી તથા વટાવવી
- (૫) તાબા હેઠળના કર્મચારીઓને જરૂરી સૂચના આપવી.
- (૬) તાબા હેઠળના કર્મચારીઓની પરચુરણ રજા તથા વળતર રજા મંજૂર કરવી.

ફરજો :

- (૧) નિગમના વાર્ષિક હિસાબો તૈયાર કરવા સહિતની તમામ પ્રકારની હિસાબી કામગીરી.
- (૨) નિગમના ખર્ચાઓ પર નિયંત્રણ અંગે સમીક્ષા કરી મેનેજીંગ ડાયરેક્ટરશ્રીને સૂચનો કરવા.
- (૩) નિગમની સર્વ પ્રકારની મિલકતોને વિવિધ પ્રકારના જોખમો સામે વીમા દ્વારા સુરક્ષિત રાખવી
- (૪) ઓડીટ વાંધાના નિકાલ કરવા.
- (૫) મેનેજીંગ ડાયરેક્ટરશ્રીની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે કામગીરી કરવી.

૧૦.

મેનેજર (વહીવટ) :

સત્તાઓ :

- (૧) મુખ્ય કચેરીના કર્મચારીઓ/અધિકારીઓએ જયોક હેઠળ મુકેલ હકક રજા/માંદગી રજાને જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટરશ્રીની મંજૂરી મેળવવી.
- (૨) નિગમના કર્મચારી/અધિકારીઓની પગાર બાંધણીની ચકાસણી કરી તેને અધિકૃત કરવી.
- (૩) મુખ્ય કચેરીના કર્મચારી/અધિકારીઓની પગાર બાંધણી, રજા, ઈજાફા, શિક્ષાત્મક હુકમો, રજાના હિસાબ વિગેરેની સર્વીસ બુકમાં નોંધો અધિકૃત કરવી.
- (૪) તાબા હેઠળના કર્મચારીઓને જરૂરી સૂચના આપવી.
- (૫) તાબા હેઠળના કર્મચારીઓની પરચુરણ રજા તથા વળતર રજા મંજૂર કરવી.
- (૬) નિશ્ચિત નાણાકીય મર્યાદા સુધીની ચીજવસ્તુઓની ખરીદી અને વાહન તથા મશીનરી મરામત કરાવવી

ફરજો:

- (૧) નિગમના કર્મચારીઓ/અધિકારીઓની તથા પ્રતિનિયુક્ત ઉપરના અધિકારીઓની મહેકમ લગત તમામ કામગીરી કરવી.
- (૨) નિગમની મુખ્ય કચેરીમાં વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓની શાખાવાર કામગીરીની સમીક્ષા કરી મેનેજીંગ ડાયરેક્ટરશ્રીના હુકમ મેળવી ફાળવણી કરવી.

- (૩) નિગમમાં આવતી તમામ ટપાલ જોઈ વાંચી મેનેજીંગ ડાયરેક્ટરશ્રીને રજૂ કરવી.
- (૪) મેનેજીંગ ડાયરેક્ટરશ્રીની સૂચના અને માર્ગદર્શન પ્રમાણે કામગીરી કરવી.

૧૧. સબ ડીવીઝનલ મેનેજર :

- સત્તાઓ :**
- (૧) ગુજરાત ગૌણ વન પેદાશ વ્યાપાર રાષ્ટ્રીયકરણ અધિનિયમ, ૧૯૭૯ ના નિયમો હેઠળ નિયત પરમીટ આપવી.
 - (૨) ગૌણ વન પેદાશોના વેચાણની ટેન્ડર નોટીસની શરતોના ભંગ બદલ ખરીદદાર પાસેથી નુકસાની વળતર વસૂલ કરવું.
 - (૩) ગૌણ વન પેદાશોના એકત્રીકરણ એજન્ટોની નિમણૂક કરવી.
 - (૪) ડીવીઝન કચેરીના ખર્ચાઓ મંજૂર કરવા તથા તેનું ચૂકવણું કરવા.
 - (૫) ડીવીઝન કચેરીના કર્મચારીઓની પરચુરણ રજા, વળતર રજા, હકક રજા તથા માંદગી રજા મંજૂર કરવી.
 - (૬) ડીવીઝન કચેરીના કર્મચારીઓની પગાર બાંધણી, રજા, ઈજાફા, શિક્ષાત્મક હુકમો, રજાના હિસાબ વિગેરેની સર્વિસ બુકમાં નોંધો અધિકૃત કરવી.
 - (૭) તાબા હેઠળના કર્મચારીઓને જરૂરી સૂચના આપવી.

- ફરજો :**
- (૧) ગૌણ વન પેદાશોનું લક્ષ્યાંક પ્રમાણે એકત્રીકરણ કરવું તથા ખરીદદારોને તે પેદાશોની વેચાણ હુકમ અનુસાર ડીલીવરી આપવા વ્યવસ્થાતંત્ર ગોઠવવું.
 - (૨) ક્ષેત્રીય વિસ્તારોમાં ગૌણ વન પેદાશોના પ્રવર્તમાન ખરીદ/વેચાણ ભાવોથી મુખ્ય કચેરીને સમયાંતરે માહિતગાર કરવી.
 - (૩) નિગમે નિયત કરેલ એકત્રીકરણ દર પ્રમાણે પ્રાથમિક એકત્રકારોને ચૂકવણું થાય તેની ખાત્રી રાખવી.
 - (૪) ગૌણ વન પેદાશો જરૂરી કાયદાકીય પરમીટ વિના વાહતુક ન થાય તેની કાળજી રાખવી.

૧૨. મેનેજર (હિસાબ) :

- ફરજો :**
- (૧) હિસાબોને લગતી કામગીરી કરવી.
 - (૨) નાણાંકીય અંકુશક તરફથી સોંપવામાં આવે તે કામગીરી કરવી.

૧૩. સીની. હિસાબનીશ :

- ફરજો :**
- (૧) હિસાબોને લગતી કામગીરી કરવી.
 - (૨) શાખાના વડા તરફથી સોંપવામાં આવે તે કામગીરી કરવી.

૧૪. હિસાબનીશ :

- ફરજો : (૧) હિસાબોને લગતી કામગીરી કરવી.
(૨) શાખાના વડા તરફથી સોંપવામાં આવે તે કામગીરી કરવી.

૧૫. સીની. એકા. આસી. :

- ફરજો : (૧) હિસાબોને લગતી કામગીરી કરવી.
(૨) શાખાના વડા તરફથી સોંપવામાં આવે તે કામગીરી કરવી.

૧૬. જુની. એકા. આસી. :

- ફરજો : (૧) હિસાબોને લગતી કામગીરી કરવી.
(૨) શાખાના વડા તરફથી સોંપવામાં આવે તે કામગીરી કરવી.

૧૭. સેકશન ઓફીસર :

- ફરજો : (૧) વહીવટને લગતી કામગીરી કરવી.
(૨) વિભાગના વડા તરફથી સોંપવામાં આવે તે કામગીરી કરવી.

૧૮. મદદનીશ વહીવટ :

- ફરજો : (૧) વહીવટને લગતી કામગીરી કરવી.
(૨) વિભાગના વડા તરફથી સોંપવામાં આવે તે કામગીરી કરવી.

૧૯. કલાર્ક :

- ફરજો : (૧) વહીવટને લગતી કામગીરી કરવી.
(૨) વિભાગના વડા તરફથી સોંપવામાં આવે તે કામગીરી કરવી.

૨૦. અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-૧ :

- ફરજો : (૧) મેનેજીંગ ડાયરેક્ટરશ્રીના અંગત મદદનીશ તરીકે ફરજ બજાવવી અને તેમના દ્વારા સોંપવામાં આવતી અન્ય કામગીરી કરવી.

૨૧. અંગ્રેજી સ્ટેનોગ્રાફર ગ્રેડ-૨ તથા ગ્રેડ-૩ :

- ફરજો : (૧) જે તે વિભાગીય વડાના અંગત મદદનીશ તરીકે ફરજ બજાવવી, વિભાગની અંગ્રેજી લઘુલિપિ તથા ટાઈપીંગની કામગીરી કરવી તથા વિભાગીય વડા દ્વારા સોંપવામાં આવતી અન્ય કામગીરી કરવી.

૨૨. ગુજરાતી સ્ટેનોગ્રાફર ગ્રેડ-૨ :

ફરજો : (૧) મુખ્ય કચેરીના વિભાગીય વડાઓના ગુજરાતી લઘુલિપિકાર તરીકે ફરજ બજાવવી તથા મેનેજર (વહીવટ) દ્વારા સોંપવામાં આવતી અન્ય કામગીરી કરવી.

૨૩. સબ ડીવીઝનલ મેનેજર :

સત્તાઓ : (૧) ગૌણ વન પેદાશોના એકત્રીકરણનું ચૂકવણું કરવું.

- ફરજો :**
- (૧) ડીવીઝનલ મેનેજર દ્વારા ફાળવવામાં આવેલ ગૌણ વન પેદાશોના લક્ષ્યાંક એજન્ટોને તથા તાબા હેઠળના મહેકમને ફાળવી તે સિધ્ધ કરવાની કામગીરી કરવી.
 - (૨) ઉચ્ચ ગુણવત્તાવાળી ગૌણ વન પેદાશોનું એકત્રીકરણ કરવું અને તેના સંગ્રહ દરમ્યાન આ ગુણવત્તા જળવાય રહે તે પ્રમાણે વ્યવસ્થા કરવી.
 - (૩) ગૌણ વન પેદાશોનો સ્ટોક તથા તેના સ્ટોક રજીસ્ટર વ્યવસ્થિત રીતે નિભાવવા.

૨૪. સુપરવાઈઝર અને આસી. સુપરવાઈઝર :

ફરજો (૧) સબ ડીવીઝનલ મેનેજર દ્વારા ફાળવવામાં આવેલ ગૌણ વન પેદાશોનો લક્ષ્યાંક સિધ્ધ કરવો.

:

(૨) ઉચ્ચ ગુણવત્તાવાળી ગૌણ વન પેદાશોનું એકત્રીકરણ થાય તે કાળજી રાખવી.

૨૫. સીનીયર પ્લાન્ટ ઈજનેર :

ફરજો (૧) વનિલ ઉદ્યોગ માટે મોટા ઓર્ડર મેળવવાની કામગીરી

:

- (૨) આઉટ સોર્સિંગ માટેની પ્રક્રિયા કરી ખરીદીની કામગીરી
- (૩) વનિલ ઉદ્યોગ માટે પ્રોડક્શન પ્લાનીંગ/સીડયુલીંગ કામગીરી
- (૪) આઉટ સોર્સિંગની કામગીરી કરાવવા અંગેઈન્સ્પેક્શન અને કવોલીટી કન્ટ્રોલની કામગીરી
- (૫) પ્રોડક્ટ ડીઝાઈન તેમજ સ્પેશીફિકેશન તૈયાર કરવા
- (૬) વનિલ ઉદ્યોગ તેમજ વડી કચેરી ખાતે સંકલનની કામગીરી
- (૭) આઈ.એસ.ઓ. અંતગર્ત વનિલ ઉદ્યોગ લગત તમામ કામગીરી
- (૮) પ્લાન્ટ અને મશીનરી અપગ્રેડેશન(ખરીદીની) કામગીરી
- (૯) ઈ.ટેન્ડરીંગ ધ્વારા પ્રોક્યોરમેન્ટ ઓફ મટીરીયલની કામગીરી
- (૧૦) વન ભવન તેમજ અન્ય ઓફીસની રીનોવેશનના પ્રોજેક્ટની તમામ કામગીરી
- (૧૧) ટેકનીકલ સર્ટીફિકેશન ઓફ જોબવર્ક બીલ
- (૧૨) આ ઉપરાંત મેનેજીંગ ડાયરેક્ટરશ્રી તથા જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટરશ્રી ધ્વારા સોંપવામાં આવતી તમામ કામગીરી.

૨૬. ડેપ્યુટી પ્લાન્ટ ઈજનેર :

ફરજો (૧) ઓર્ડર કન્ફરમેશન તથા ડ્રોઈંગ મુજબ ફ્રેમ, શટર્સ ગણતરી કરી ઈન્ડેન્ટનું મટીરીયલ તથા લાકડાના ઘનમીટર કાઢી સ્ટોરેજ સેક્શનમાં આપવાની કામગીરી.

:

- (૨) સ્ટોરેજ સેક્શનમાંથી બારી-બારણાની સાઈઝ આવે ત્યારે તે સાઈઝ ચેક કરી માપ મુજબ જાડાઈ, પહોળાઈ તૈયાર કરવા માટે ઓપરેટરને જાણ કરવાની
- (૩) સાઈઝ તૈયાર થયા પછી ફ્રેમ, શટર્સનું માર્કિંગ કરવા માટે કામગીરી પત્રક ભરી ડ્રોઈંગ બનાવી આપવાનું.
- (૪) માર્કિંગ થયેલા ફ્રેમ શટર્સનું ડ્રોઈંગ મુજબ માર્કિંગ થયા કે નહિ તેની ચકાસણી કરી ઓપરેશનમાં આપવાનું ઓપરેશનમાં ડ્રીલીંગ મોટાયઝીક તથા છાલ કાઢવાનું ફીલ-ફીલ મારવાનું, દાંતી ફોડવાનું કામ ઓપરેટરને બતાવવાનું.
- (૫) વુડવર્કિંગમાંથી ફ્રેમ તથા શટર્સનું મટીરીયલ તૈયાર થયા પછી ફીટીંગ માટે એસેમ્બલીમાં જાય ત્યારે એસેમ્બલીમાં

ફીટીંગનું કામ જોવાનું તથા માપ મુજબ (ડ્રોઈંગ મુજબ) ચેક કરવાનું.

- (૬) વુડવર્કિંગ વિભાગમાં ઈન્ટેન્ટ બુક ભરવાની કામગીરી, આવક-જાવકનું રજીસ્ટર, મંથલી પ્રોગ્રેસ રીપોર્ટ ભરવાનું કામ કરવાનું. તદઉપરાંત આઈએસઓ નો રેકોર્ડ ભરવાની કામગીરી તેમજ ફર્નીચર વિભાગની કામગીરીનું સુપરવાઈઝરની કામગીરી ચેક કરવાની.
- (૭) વર્ક્સ મેનેજરશ્રી તરફથી સોંપવામાં આવતી અન્ય કામગીરી.

૨૭. સીનીયર કલાર્ક :

- (૧) અધિકારી/કર્મચારીઓની સેવાપોથીમાં રજા/ઈજાફા/એલટીસી/વચનિવૃત્તિ અંગે હકક રજાનું રોકડમાં રૂપાંતર કરવાની નોંધ કરવાની કામગીરી
- (૨) ખાનગી અહેવાલના મુસદ્દા તૈયાર કરવા
- (૩) ટેલીફોન બીલ/ગેસ બીલ/ ઈલેક્ટ્રીક બીલ વગેરેની નોંધણી કરવી
- (૪) સ્ટેશનરી અને આર્ટીકલ્સના વિતરણની કામગીરી
- (૫) વિભાગીય વડાઓ ધ્વારા સોંપવામાં આવેલ કામગીરી

૨૮

આયુર્વેદીક ફાર્માસીસ્ટ

- (૧) નો. ઠન::મ?બ્દગ)બ'તચ્ચ્ચ-ચ્ચ'ત્-ભ્ત ના ધારાધોરણ મુજબ ઉત્પાદન કરવાની કામગીરી કરવી.
- (૨) ઉત્પાદન એકમમાં હાલ ઉત્પાદિત થતી બનાવટોની ગુણવત્તા ચકાસીને જરૂર જણાય ત્યાં ગુણવત્તાલક્ષી ફેરફાર કરવા જેથી ગૌણ વન પેદાશોનું વધુમાં વધુ મુલ્યવર્ધન મળી શકે.
- (૩) નવા પેટન્ટ અને પ્રોપરાઈટરી પ્રોડક્ટ્સ તૈયાર કરી તેના ઉત્પાદન અને વેચાણ અંગે મંજૂરી મેળવવાની કામગીરી કરવી.
- (૪) શાસ્ત્રોક્ત ઔષધોને તૈયાર કરી તેના ઉત્પાદન અને વેચાણ માટે મંજૂરી મેળવવાની કામગીરી કરવી.
- (૫) જે આયુર્વેદીક ઔષધોની ઉત્પાદન માટે મંજૂરી મળેલ છે તેવા ઔષધોનું ઉત્પાદન ચાલુ કરવામાં મદદ કરવી.
- (૬) ઉત્પાદન એકમમાં આરોગ્યપ્રદ વ્યૂહ અપનાવી એકમનો ઉત્પાદન વિસ્તાર ચોખ્ખો રાખવો અને તે બાબતે કામદારોને તાલીમ તથા સમજ આપવી.
- (૭) ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગર તેમજ વિવિધ કચેરીઓ સાથે ઉત્પાદન લાયસન્સ વિગરે માટે તેને લગતી કામગીરીનું સંકલન કરવાની કામગીરી કરવી.
- (૮) ઉત્પાદન એકમમાં કામ કરતા કર્મચારીઓને સમયાંતરે વિવિધ જાતની ટ્રેનીંગ આપવી.
- (૯) હાલના ઉત્પાદનો તેમજ નવા ઉત્પાદનો તૈયાર કરવા માટે ઉત્પાદન પ્રક્રિયામાં જરૂર જણાય ત્યાં નવા મશીનો અને સાધન સામગ્રી ખરીદ કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપવું.
- (૧૦) ઉત્પાદન પ્રક્રિયામાં પ્રોડક્ટની ગુણવત્તા જાળવવા માટે જરૂરી તમામ પગલા લેવા અને સ્ટાન્ડર્ડ બનાવવા અને સ્ટાન્ડર્ડ સેમ્પલોનો સંગ્રહ કરવો અને નિભાવવો.
- (૧૧) ઉત્પાદનને લગતા રેકોર્ડ નિભાવવાના રહેશે.

૨૯

લેબ ટેકનીશીયન

- (૧) બધા પ્રકારના કાચા માલની ચકાસણી હાથ ધરવી.
- (૨) પ્રોસેસમાં રહેલ કાચામાલનું મોનીટરીંગ કરવું.
- (૩) તૈયાર થઈ ગયેલ માલની ગુણવત્તા નિયંત્રણ માટે ગુણવત્તા ચકાસણી હાથ ધરવી.
- (૪) જીએમ નિયમો મુજબ સ્ટોરેજ કરેલ કાચી સામગ્રી, અર્ધતૈયાર માલ અને તૈયાર માલના સ્ટોરેજની સ્થિતિનું મોનીટરીંગ
- (૫) દવાઓની સેલ્ફ લાઈફ ચકાસી કરવાનું અને સ્ટોરેજની જરૂરીયાતનું રેકર્ડ રાખવું.
- (૬) સમાજના વ્યાપક હિતમાં કોર્પોરેશન અને શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ વગેરે વચ્ચે જ્ઞાનનું વિનિમય કરવું.
- (૭) જીએમ નિયમો મુજબ પ્રયોગશાળાના પ્રવૃત્તિઓ સારી બને તે બાબતોને પ્રોત્સાહન આપવું.
- (૮) એમએફપી પ્રોસેસીંગ સગવડોમાં સુધારો કરવો.

૩૦

પ્રોડક્શન સુપરવાઈઝર

ઉત્પાદનની કામગીરી ઉપર દેખરેખ રાખવી
ચૂર્ણ પેકીંગ ઉપર દેખરેખ રાખવી
ડીવી. મેનેજર ધ્વારા સોંપવામાં આવેલ કામગીરી

પ્રકરણ-૪

દેખરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતિ

૪.૧ જુદા જુદા મુદ્દાઓ અંગે નિર્ણય લેવા માટે કઈ કાર્યપદ્ધતિ અનુસરવામાં આવે છે?

કોઈપણ મુદ્દા અંગે નિર્ણય લેવા માટે જે તે શાખાના વડા દ્વારા મેનેજીંગ ડાયરેક્ટરશ્રીને નોંધ મૂકવામાં આવે છે. ખરીદ, વેચાણ કે મહેકમને લગતી બાબતોની નોંધમાં જે લાગુ પડતું હોય તે અનુસાર સંબંધિત ટેન્ડર નોટીસ / કરારનામાની શરતો કે સેવાનિયમોના સંદર્ભનો નોંધમાં ઉલ્લેખ કરવામાં આવે છે. જો તે મુદ્દા પર મેનેજીંગ ડાયરેક્ટરશ્રી તેમને બોર્ડ ઓફ ડાયરેક્ટર દ્વારા સોંપવામાં આવેલ સત્તા પ્રમાણે નિર્ણય લેવા માટે સક્ષમ હોય તો તેમને સોંપવામાં આવેલ તેવી સત્તાનો સંદર્ભ નોંધમાં ટાંકવામાં આવે છે અને તે અનુસાર મેનેજીંગ ડાયરેક્ટરશ્રી દ્વારા નિર્ણય લેવામાં આવે છે. મેનેજીંગ ડાયરેક્ટરશ્રીને મળેલ સત્તાઓ પૈકી કેટલીક સત્તાઓ જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટરશ્રીને સોંપવામાં આવેલ છે જેને લગતી બાબતો જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટરશ્રી દ્વારા નિર્ણયિત થાય છે.

૪.૨ અગત્યની બાબતો માટે કોઈ ખાસ નિર્ણય લેવા માટેની દસ્તાવેજી કાર્યપદ્ધતિઓ/ ઠરાવેલી કાર્યપદ્ધતિઓ/ નિયત માપદંડો/નિયમો કયા કયા છે? નિર્ણય લેવા માટે કયા કયા સ્તરે વિચાર કરવામાં આવે છે?

અગત્યના નિર્ણય લેવા માટે જો સક્ષમ સત્તાધીશ બોર્ડ ઓફ ડાયરેક્ટર હોય તો મુદ્દા હેઠળની બાબત મેનેજીંગ ડાયરેક્ટરશ્રી દ્વારા પ્રાથમિક સ્તરે મંજૂર થઈને બોર્ડ ઓફ ડાયરેક્ટર સમક્ષ નિર્ણયાર્થે રજૂ કરવામાં આવે છે અને તે અનુસાર તે મુદ્દા પર નિયામક મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવે છે.

તે જ પ્રમાણે જો કોઈ વધુ અગત્યના મુદ્દા પર નિર્ણય લેવા માટેની સત્તા રાજ્ય સરકાર પાસે હોય બોર્ડ ઓફ ડાયરેક્ટર દ્વારા તેને મંજૂર કરાયા બાદ તેને અંતિમ નિર્ણય અર્થે સરકારશ્રી સમક્ષ રજૂ કરવામાં આવે છે.

૪.૩ નિર્ણયને જનતા સુધી પહોંચાડવાની કઈ વ્યવસ્થા છે?

નિગમ દ્વારા દર વર્ષે નિયત કરવામાં આવતા ગૌણ વન પેદાશના એકત્રીકરણ દરો પ્રાથમિક એકત્રકારો સુધી પહોંચાડવા માટે નીચે પ્રમાણે વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે.

- (૧) એકત્રીકરણ દરો વર્તમાનપત્રોમાં પ્રસિધ્ધ કરવામાં આવે છે.
- (૨) એકત્રીકરણ દરો નિગમની વિભાગીય કચેરીઓમાં પરિપત્રિત કરવામાં આવે છે અને આ પરિપત્રો દરેક કચેરીમાં નોટીસ બોર્ડ ઉપર પ્રદર્શિત કરવામાં આવે છે.
- (૩) નિગમના અધિકૃત એજન્ટોના વેપારના સ્થળે આ એકત્રીકરણ દરો દર્શાવતા બોર્ડ રાખવામાં આવે છે.
- (૪) ટીમરૂ એકમના દરેક ફ્ડ પર ટીમરૂપાનના એકત્રીકરણ દર દર્શાવતા બોર્ડ રાખવામાં આવે છે.

૪.૪ નિર્ણય લેવાની પ્રક્રિયામાં જેના મંતવ્યો લેવાનાર છે તે અધિકારીઓ કયા છે ?

નિર્ણય લેવાની બાબતમાં જો કોઈ નાણાંકીય બાબત સંકળાયેલ હોય તો નિગમના નાણાંકીય અંકુશકનું મંતવ્ય લેવામાં આવે છે જ્યારે તેમાં જો કોઈ કાયદાકીય બાબત સંકળાયેલ હોય તો નિગમના કંપની સચિવનું મંતવ્ય લેવામાં આવે છે.

૪.૫ નિર્ણય લેનાર અંતિમ સત્તાધિકારી કોણ છે?

ઉપર ૪.૧ તથા ૪.૨ માં દર્શાવ્યાનુસાર નિર્ણય લેનાર અંતિમ સત્તાધિકારી નિગમના મેનેજીંગ ડાયરેક્ટરશ્રી નિગમનું બોર્ડ ઓફ ડાયરેક્ટર અને સરકારશ્રી છે.

૪.૬ જે અગત્યની બાબતો પર જાહેર સત્તાધિકારી દ્વારા નિર્ણય લેવામાં આવે છે તેની માહિતી :

(૧) ખરીદીની બાબત

ગુજરાત સરકારશ્રીના ઉદ્યોગ અને ખાણ વિભાગના ઠરાવ ક્રમાંક:એસપીઓ/૧૦૨૦૧૫/૬૯૧૦૯૩/ચ તારીખ ૩-૦૬-૨૦૧૬થી ગુજરાત રાજ્ય ખરીદ નિતી ૨૦૧૬ બહાર પાડવામાં આવેલ છે. નિગમ સદરહુ ખરીદી નિતીને અનુસરીને કામગીરી કરે છે તથા નભે .:ચલ્મિારફતે પણ ખરીદી કરે છે.

નિગમમાં ચીજવસ્તુઓની ખરીદી સરકારશ્રી દ્વારા સમયાંતરે જારી કરવામાં આવતી માર્ગદર્શક સૂચનાઓ અનુસાર કરવામાં આવે છે.

સરકારશ્રીએ ઠરાવેલા ધોરણો મુજબ ચીજવસ્તુઓના ખરીદમૂલ્યના આધારે આ ખરીદી સીધે સીધી અથવા ખરીદીનું જાહેરનામું પરિપત્રિત કરીને ભાવપત્રકો મેળવીને અથવા વર્તમાનપત્રમાં જાહેરાત દ્વારા ટેન્ડર નોટીસ પ્રસિધ્ધ કરીને કરવામાં આવે છે.

ખરીદીના નિર્ણય અંગે નિગમમાં નીચે જણાવ્યાનુસાર ત્રિ-સ્તરીય માળખુ કાર્યરત છે.

- (ક) ઠરાવેલ નાણાંકીય મર્યાદા સુધીની સામાન્ય ચીજવસ્તુઓની ખરીદીનો નિર્ણય નિગમમાં ખરીદ વિભાગનો હવાલો સંભાળતા સીની. મેનેજર દ્વારા કરવામાં આવે છે.
- (ખ) ઠરાવેલ નાણાંકીય મર્યાદા ઉપરની પરંતુ બોર્ડ ઓફ ડાયરેક્ટરે સોપેલ સત્તાની મર્યાદામાં આવતી ખરીદીનો નિર્ણય નિગમના જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટરશ્રી અને મેનેજીંગ ડાયરેક્ટરશ્રી કરે છે. તેઓ આ નિર્ણય નિગમના અધિકારીઓની બનેલી ખરીદ સમિતિની ભલામણના આધારે કરે છે.
- (ગ) મેનેજીંગ ડાયરેક્ટરશ્રીને સોપવામાં આવેલ સત્તાની નાણાંકીય મર્યાદા ઉપરની ખરીદીનો નિર્ણય નિયામકોની બનેલી ખરીદ સમિતિ દ્વારા કરવામાં આવે છે. સામાન્ય રીતે નિગમના અધિકારીઓની બનેલી ખરીદ સમિતિ દ્વારા કરવામાં આવેલ ભલામણોના આધારે આ નિર્ણય લેવામાં આવે છે.

ખરીદી અંગેનો નિર્ણય લેવાની કાર્યવાહીમાં સંકળાયેલ અધિકારીઓના હોદ્દા નીચે પ્રમાણે છે.

- (૧) જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટર
- (૨) કંપની સચિવ
- (૩) સીની. મેનેજર
- (૪) નાણાંકીય અંકુશક
- (૫) ખરીદીનો ઈન્ડેન્ટ મૂકનાર અધિકારી

આ અધિકારીઓનું સંપર્ક સ્થળ નિગમની મુખ્ય કચેરી છે.

જો ખરીદીની બાબત અંગેના નિર્ણયથી સંતોષ ન થયો હોય તો નિગમની મુખ્ય કચેરીએ નિગમના મેનેજીંગ ડાયરેક્ટરશ્રીને અપીલ કરી શકાય.

(ર) વેચાણની બાબત

- (ક) ગૌણ વન પેદાશો, વાવેતરો તથા ચારકોલના જથ્થાબંધ વેચાણનો નિર્ણય ડાયરેક્ટરોની બનેલી વેચાણ સમિતિ દ્વારા કરવામાં આવે છે જે અંગે જે તે ચીજવસ્તુના વેચાણની ટેન્ડર નોટીસમાં જણાવેલ પ્રક્રિયા/શરતો અનુસરવામાં આવે છે.
- (ખ) ગૌણ વન પેદાશોનું છુટક વેચાણ તથા આયુર્વેદિક દવાઓનું જથ્થાબંધ/છુટક વેચાણ તેની નિયત કરવામાં આવેલ વેચાણ કિંમતે નિગમના એજન્ટો, છુટક વેચાણ કેન્દ્રો તથા મોબાઈલ વાન દ્વારા કરવામાં આવે છે.
- (ગ) વનિલ ઉદ્યોગ નિર્મિત ચીજવસ્તુઓનું વેચાણ નિયત કરવામાં આવેલ વેચાણ કિંમતે વેચાણના ઓર્ડરો મેળવીને કરવામાં આવે છે.

ગૌણ વન પેદાશો, વાવેતરો તથા ચારકોલના જથ્થાબંધ વેચાણનો નિર્ણય લેવાની કાર્યવાહીમાં સીની. મેનેજર (એમએફપી) સંકળાયેલા છે જેમનું સંપર્ક સ્થળ નિગમની મુખ્ય કચેરી છે.

જો વેચાણની બાબત અંગેના નિર્ણયથી સંતોષ ન થયો હોય તો નિગમની મુખ્ય કચેરીએ નિગમના મેનેજીંગ ડાયરેક્ટરશ્રીને અપીલ કરી શકાય.

પ્રકરણ-૫

કાર્યો કરવા માટે નિગમે નક્કી કરેલા ધોરણો

વિવિધ પ્રવૃત્તિઓ/કાર્યક્રમો હાથ ધરવા માટે નિગમે નક્કી કરેલ ધોરણોની વિગતો નીચે પ્રમાણે છે.

૧. ગૌણ વન પેદાશ પ્રવૃત્તિ :

ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિ. ધ્વારા ગૌણ વન પેદાશોના એકત્રીકરણ અને સંગ્રહણની કામગીરી ગુજરાત રાજ્યમાં ૧૯૭૬થી કરતું આવ્યું છે. ગુજરાત રાજ્યના અનુસુચિત અને બિન અનુસુચિત વિસ્તારોમાં આવતા જીલ્લાઓમાં ૦૫ ડીવીઝન કચેરીઓ ધ્વારા આ કામગીરી કરવામાં આવે છે. દર વર્ષે ૩૫ હજારથી વધુ એકત્રકારો ધ્વારા ગૌણ વન પેદાશોના એકત્રીકરણ થકી અંદાજીત ૧૫ થી ૧૭ કરોડની આજીવીકાના સ્વરૂપે મેળવે છે.

પેસા નિયમ ૨૦૧૭ના ૩૯(૧) અને (૨) મુજબ ગ્રામ સભાઓ પાસેથી ઠરાવો મેળવી ગૌણ વન પેદાશોનું એકત્રીકરણ, સંગ્રહ અને વેચાણની કામગીરી કરવામાં આવી રહેલ છે. જેમાં એકત્રીકરણ અને વેચાણ થકી જો નફો થાય તો તે એકત્રકારોને ચુકવવામાં આવે છે. રાજ્યમાં મુખ્યત્વે ટીમરૂપાન, મહુડાકુલ, મહુડાડોળી, મધ, અને વિવિધ જાતના ગુંદરો, મોટા જથ્થામાં એકત્રિત કરવામાં આવે છે.

૨. વનિલ ઉદ્યોગ :

" વનિલ ઉદ્યોગ " એ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિ.નું એકમ છે. આ એકમ નવતાડ, તા.વાંસદા, જી.નવસારી ખાતે આવેલ છે. આ એકમમાં પરંપરાગત ઈમારતી લાકડાની વૈદ્યાતિક ઢબે રસાયણિક અને નિર્જલન પ્રક્રિયા કરવામાં આવે છે. જેથી ફુગ, જીવાત, ઉઘઈની સામે લાકડાને વધુ સમય માટે સંરક્ષણ મળે છે. આ એકમ ધ્વારા વિધિવત ઉત્પાદન મે-૧૯૮૨થી શરૂ કરવામાં આવેલ છે. વનિલ ઉદ્યોગમાં સાગી તેમજ બિન સાગી લાકડામાંથી બારી, બારણાં, ફર્નિચર, લાકડાના ફ્રેમ્સ વિગેરે ઉત્પાદન કરી તેને ગુજરાત સરકારના વિવિધ વિભાગોમાં તેમજ શૈક્ષણિક સંસ્થાઓને જરૂરત મુજબ સપ્લાય કરવામાં આવે છે. આ એકમ મુખ્યત્વે સ્થાનિક આદિવાસીઓને લકડા કામને લાગતી કુશળતા કેળવી અને રોજગારીની મોટી તકો ઉભી કરવા માટે પ્રયત્નશીલ છે.

૩. ધન્વંતરી એકમ :

ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ ધ્વારા એકત્ર કરવામાં આવતી વિવિધ જાતની આયુર્વેદિક ઔષધિઓની દવા બનાવવાના ગુણ ધરવાતા વિવિધ ગૌણ વન પેદાશોમાંથી નિગમ ધ્વારા છેલ્લા ૩૨ વર્ષથી આયુર્વેદિક ઔષધોનું ઉત્પાદન કરવા માટે આયુર્વેદિક ફાર્માષીની સ્થાપના કરવામાં આવેલ છે. આ એકમ " ધન્વંતરી એકમ " તરીકે રાજ્યમાં જાણીતું છે. સરદ એકમને રાજ્ય સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તરફથી ગુણવત્તા માટે "GMP" સર્ટીફિકેટ મળેલ છે. આ એકમમાં ચૂર્ણ, ટેબલેટ, તેલ તેમજ પેટન્ટ અને પોપરાઈટરી સ્વરૂપે વિવિધ જાતની આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. તેજમ મધના પ્રોસેસીંગ અને પેકીંગ પણ કરવામાં આવે છે. તેના તમામ ઉત્પાદનો " ધન્વંતરી " બ્રાન્ડ હેઠળ રાજ્યના વિવિધ શહેરોમાં આવેલ વેચાણ કેન્દ્રો મારફતે કરવામાં આવે છે.

પ્રકરણ-૬

કાર્યો કરવા માટેના નિયમો, વિનિયમો, સૂચનાઓ, નિયમસંગ્રહો અને દફતરો

નિગમ અથવા તેના નિયંત્રણ હેઠળના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉપયોગ કરવાના નિયમો, વિનિયમો, સૂચનાઓ, નિયમસંગ્રહ અને દફતરોની યાદી નીચે પ્રમાણે છે.

૧. સેવા નિયમો :

૧. દસ્તાવેજનો પ્રકાર : નિયમો
૨. દસ્તાવેજ પરનું ટૂંકું લખાણ : સેવાનિયમો
૩. વ્યક્તિને નકલ અહીંથી મળશે : મેનેજર (વહીવટ)
: ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ,
'વનગંગા', ૭૮, અલકાપુરી, વડોદરા-૩૯૦૦૦૭
ટેલીફોન નંબર : ૨૩૧૨૮૨૦, ફેક્સ નંબર : ૨૩૫૫૨૯૩
૪. નકલ લેવા માટેની ફી : અરજી ફી રૂપિયા વીસ વત્તા માહિતીના પાના દીઠ રૂપિયા બે.

૨. જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટરશ્રી/ મેનેજીંગ ડાયરેક્ટરશ્રીને સોંપવામાં આવેલ સત્તાઓ :

૧. દસ્તાવેજનો પ્રકાર: વિનિયમો
૨. દસ્તાવેજ પરનું ટૂંકું લખાણ : જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટરશ્રી/ મેનેજીંગ ડાયરેક્ટરશ્રીને સોંપવામાં આવેલ સત્તાઓ
૩. વ્યક્તિને નકલ અહીંથી મળશે : કંપની સચિવ
: ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ,
'વનગંગા', ૭૮, અલકાપુરી, વડોદરા-૩૯૦૦૦૭
ટેલીફોન નંબર : ૨૩૪૪૮૫૨, ફેક્સ નંબર : ૨૩૫૫૨૯૩
૪. નકલ લેવા માટેની ફી: અરજી ફી રૂપિયા વીસ વત્તા માહિતીના પાના દીઠ રૂપિયા બે.

૩. મેમોરેન્ડમ એન્ડ આર્ટીકલ્સ ઓફ એસોસીએશન :

૧. દસ્તાવેજનો પ્રકાર: ધારાધોરણો
૨. દસ્તાવેજ પરનું ટૂંકું લખાણ: મેનેજીંગ ડાયરેક્ટરશ્રીને સોંપવામાં આવેલ સત્તાઓ
૩. વ્યક્તિને નકલ અહીંથી મળશે: કંપની સચિવ
: ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ,
'વનગંગા', ૭૮, અલકાપુરી, વડોદરા-૩૯૦૦૦૭
ટેલીફોન નંબર : ૨૩૪૪૮૫૨, ફેક્સ નંબર : ૨૩૫૫૨૯૩
૪. નકલ લેવા માટેની ફી : અરજી ફી રૂપિયા વીસ વત્તા માહિતીના પાના દીઠ રૂપિયા બે.

પ્રકરણ-૭

નિગમ પાસે અથવા તેના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક

નિગમ પાસે અથવા તેના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોના વર્ગોનું પત્રક નીચે પ્રમાણે છે.

અ.નં	દસ્તાવેજનો વર્ગ	દસ્તાવેજનું નામ અને તેની એક લીટીમાં ઓળખાણ	દસ્તાવેજ મેળવવાની કાર્યપદ્ધતિ	નીચેની વ્યક્તિ પાસે છે / તેના નિયંત્રણમાં છે
૧.	નિયમો	સેવા નિયમો	નમૂના "ક" માં અરજી કરીને	મેનેજર (વહીવટ)
૨.	વિનિયમો	જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટરશ્રી/ મેનેજીંગ ડાયરેક્ટરશ્રીને સોંપવામાં આવેલ સત્તાઓ	નમૂના "ક" માં અરજી કરીને	કંપની સચિવ
૩.	ધારાધોરણો	મેમોરેન્ડમ એન્ડ આર્ટીકલ્સ ઓફ એસોસીએશન	નમૂના "ક" માં અરજી કરીને	કંપની સચિવ

પ્રકરણ—૮

નિગમની નીતિ ઘડતરના અથવા તેના અમલીકરણના સંબંધમાં જનતાના સભ્યો સાથે વિચારવિનિમય માટે અથવા તેમના દ્વારા રજૂઆત માટેની વિદ્યમાન કોઈ ગોઠવણની વિગતો

નિગમ એક સરકારી કંપની હોવાથી તેની નીતિ સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ નીતિને અનુરૂપ હોય છે. સરકારશ્રીની નીતિને અનુરૂપ નીતિનું ઘડતર અને તેનો અમલ નિગમમાં કઈ રીતે કરવો તે નિગમના બોર્ડ ઓફ ડાયરેક્ટર દ્વારા નક્કી કરવામાં આવે છે.

બોર્ડ ઓફ ડાયરેક્ટરના સભ્યોની નિમણુંક રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી દ્વારા કરવામાં આવે છે. આ મંડળમાં સરકારી અધિકારીઓ ઉપરાંત બિનસરકારી સભ્યો—જેઓ મોટેભાગે સામાજિક કાર્યકરો હોય છે—નું પ્રતિનિધિત્વ પણ હોય છે. બિનસરકારી સભ્યો રાજ્યના જુદા જુદા વિસ્તારોમાંથી તેમજ જુદા જુદા વર્ગમાંથી નક્કી કરાઈને નિયુક્ત કરવામાં આવે છે. આ વ્યવસ્થાને કારણે તેઓ નીતિ ઘડતર કે નીતિના અમલ પ્રસંગે જનતાની લાગણી રજૂ કરી શકે છે. આ પ્રમાણે નિગમની નીતિ ઘડતરમાં જનતા પણ પરોક્ષ રીતે સહભાગી બને છે.

પ્રકરણ-૯
નિગમના ભાગ તરીકે રચાયેલી બોર્ડ, પરિષદ, સમિતિઓ અને અન્ય
સંસ્થાઓનું પત્રક
નિયામક મંડળ : (તારીખ ૦૧-૦૫-૨૦૨૩નાં રોજની સ્થિતિએ)

અ.નં.	નિયામકશ્રીનું નામ	હોદ્દો
૧	(હાલ ખાલી)	અધ્યક્ષશ્રી
૨	(હાલ ખાલી) નાયબ સચિવશ્રી(સંકલન) આદિજાતિ વિકાસ વિભાગ	નિયામકશ્રી
૩	શ્રી બી. વાય વી સત્યનારાયણ, ડાયરેક્ટરશ્રી (ઈન્સ્ટીટ્યુશનલ ફાઈનાન્સ) નાંણા વિભાગના પ્રતિનિધિશ્રી	નિયામકશ્રી
૪	શ્રી બી એલ ચૌધરી, નાયબ સચિવશ્રી (વન) (વન અને પર્યાવરણ વિભાગ)	નિયામકશ્રી
૫	શ્રી એસ કે ચતુર્વેદી, IFS અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને (HoFF), ગુજરાત રાજ્ય	નિયામકશ્રી
૬	શ્રી મહેશ સિંઘ, IFS	મેનેજીંગ ડાયરેક્ટરશ્રી
૭	શ્રી રામ રતન નાલા, IFS	જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટરશ્રી

ઓડીટ સમિતિ :

અ.નં.	ડાયરેક્ટરશ્રીનું નામ	હોદ્દો
૧	ડાયરેક્ટરશ્રી, ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિ. અને અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી, તથા હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગુજરાત રાજ્ય (હોદ્દા જોગ)	અધ્યક્ષશ્રી
૨	ડાયરેક્ટરશ્રી, ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિ. અને સંયુક્ત/નાયબ/અધિક સચિવશ્રી, વન અને પર્યાવરણ વિભાગ, ગાંધીનગર (હોદ્દા જોગ)	સભ્યશ્રી
૩	ડાયરેક્ટરશ્રી, ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિ. અને નાણાં વિભાગના પ્રતિનિધિશ્રી, નાંણા વિભાગ, ગાંધીનગર (હોદ્દા જોગ)	સભ્યશ્રી
૪	મેનેજીંગ ડાયરેક્ટરશ્રી, ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમીટેડ, (હોદ્દા જોગ)	સભ્યશ્રી
૫	ઈ.ચા. જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટરશ્રી ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમીટેડ (હોદ્દા જોગ)	સભ્યશ્રી

પ્રકરણ-૧૦

નિગમના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી પુસ્તિકા (ડીરેક્ટરી)

૧. મુખ્ય કચેરી

ક્રમ	નામ	હોદ્દો	એસટીડી કોડ નં.	ફોન નંબર		ફેક્સ	ઈ-મેઈલ	સરનામું
				કચેરી	ઘર			
૧	શ્રી મહેશ સિંઘ આઈએફએસ	મેનેજીંગ ડાયરેક્ટર	૦૨૬૫	૨૩૫૫૨૯૧	મો.૯૮૭૯૫૫ ૧૦૫૯	૨૩૫૫૨૯૩	mdgsfdc@gmail.com	૭૦૧, રાજવી ટાવર, રાજવંશ કોપલેક્ષ, બોડકદેવ, અમદાવાદ
૨	શ્રી રામ રતન નાલા આઈએફએસ	ઈ.ચા.જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટર	૦૨૬૫	૨૩૫૫૨૯૧	8141480032	૨૩૫૫૨૯૩	gsfdcltd@gmail.com	૨૦૧, જી માઈલસ્ટોન રેસીડન્સ વાસના ભાયલી રોડ, વડોદરા
૩	શ્રી એમ આર પટેલ	સીની. મેનેજર (માર્કેટીંગ)	૦૨૬૫	૨૩૫૫૨૯૦	મો.નં.૯૮૨૫૮ ૭૩૯૮૫	૨૩૫૫૨૯૩	gsfdcltd@gmail.com	એ-૧૫૫, પુષ્પક ટાઉનશીપ, રીલાયન્સ સ્ટેડીયમનીસામે ઉંડેરા, વડોદરા
૪	શ્રી આર બી લિમ્બચીયા	કંપની સચિવ કમ સીનીયર મેનેજર (લીગલ એન્ડ પર્સોનેલ) ઈ.ચા.સીની. પ્લાન્ટ ઈજનેર	૦૨૬૫	૨૩૧૨૨૨૦	મો. ૯૯૧૩૭ ૨૫૭૭૭	૨૩૫૫૨૯૩	gsfdcltd@gmail.com	૨૦૩, નવધા રેસીડન્સી ટાવર-૧, વુડા ચાર રસ્તા પાસે, ગોત્રી, વડોદરા-૨૧
૫	શ્રી પંકજ એચ જીમુલીયા	નાણાંકીય અંકુશક ઈ.ચા.મેનેજર (વહીવટ)	૦૨૬૫	૨૩૧૨૨૨૦	મો. ૯૮૭૯૪ ૪૯૦૭૬	૨૩૫૫૨૯૩	gsfdcltd@gmail.com	૭૭, શિલાલેખ દુપ્લેક્ષ, રેલ્વે સ્ટેશન નજીક, વડોદરા
૬	શ્રી અક્ષયકુમાર લીમ્બચીયા	પ્લાન્ટ ઈજનેર કરારાધારિત	૦૨૬૫	૨૩૧૨૨૨૦	મો.૯૮૯૮૮૦ ૦૭૨૧	-	-	C/4044 Someshwar Haritage, Manav Ashram Circle, Mahesana-384001
૭	શ્રી જીગ્નેશ એચ વસાવા	પ્લાન્ટ ઈજનેર કરારાધારિત	-	-	મો.૯૦૩૩૧ ૧૫૫૦૦	-	jigneshvasava6737@gmail.com	489-2, Behind Petrol Pump Sultanpura, Jhagdia, 393110 Bhaurch
૮	શ્રી મુજાલ બી શાહ	ડીવી.મેનેજર, એમએસપી કરારાધારિત	૦૨૬૫	૨૩૧૨૨૨૦	9898926896	-	-	બી/૧૦ લક્ષ્મી નારાયણ સો. જલારામ નગરની પાછળ, ઉમંગ સો. પાસે, ગોત્રીરોડ, વડોદરા
૯	શ્રી આર સી વસાવા	સીની. એકા. આસી.	૦૨૬૫	૨૩૧૨૨૨૦	મો.૯૯૨૫૬ ૭૦૯૦૯	૨૩૫૫૨૯૩	rameshvasava@gmail.com	મુ. પો. પુનીયાદ, તા. શીનોર, જી. વડોદરા
૧૦	શ્રી એમ ડી રાઠોડ	જુની. એકા. આસી.	૦૨૬૫	૨૩૧૨૨૨૦	મો.૯૯૯૯૫ ૭૩૯૭૯	-	-	સી-૧૪, સહજાનંદ સોસા. બનભણસભા હોલ પાસે, નવાબજાર, કરજણ જી.વડોદરા

૧૧	શ્રી એ કે પંડયા	ઈ.ચા. મેનેજર (વહીવટ)જુની. એકા. આસી.	૦૨૬૫	૨૩૧૨૮૨૦	મો.૯૮૯૮૬ ૪૦૫૮૧	-	amitpan dya1967 @gmail. com	સી/૧૩, સાંઈનાથ સોસા. (ડુપ્લેક્ષ), ૫૨ કોમ્પલેક્ષ પાછળ, ગેરી કંપાઉન્ડ, શીવાંજલી સોસા.ની બાજુમાં, ગોત્રી રોડ, વડોદરા
૧૨	શ્રી પી એસ શાહ	જુની. એકા. આસી.	૦૨૬૫	૨૩૧૨૮૨૦	મો.૯૮૨૫૬ ૫૫૮૯૬	-	-	૮-બી, ભુવનેશ્વરી સોસા. જનકલ્યાણ સોસા. પાછળ, પોસ્ટ ઓફીસ પાસે, આજવા રોડ, વડોદરા
૧૩	શ્રી સી જી. કોલયા	જુની.એકા. આસી.	૦૨૬૫	૨૩૧૨૮૨૦	મો. ૯૮૭૯૨ ૪૪૬૦૧	-	-	૧૦૮૭, વિશાલનગર, ગુ.હા.બોર્ડ, અંબામાતાના મંદિરની બાજુમાં, તરસાલી, વડોદરા
૧૪	શ્રી એન. આર. શાહ	જુની. એકા. આસી.	૦૨૬૫	૨૩૧૨૮૨૦	મો. ૯૮૭૯૯ ૪૦૦૧૦	-	-	જૈન વાગા, શેઠ શેરી, ડભોઈ જી. વડોદરા
૧૫	શ્રીમતી જે પી જાધવ	કલાર્ક	૦૨૬૫	૨૩૧૨૮૨૦	મો.૯૮૨૪૧ ૬૪૫૩૮	-	-	૪, રૂદ્રાક્ષ ડુપ્લેક્ષ, શ્વેતાપાર્કની પાછળ, વોર્ડ નં.૨ ઓફીસ સામે, હરણી વારસીયા રીંગરોડ, વડોદરા-૨૨
૧૬	શ્રીમતી બી પી પટેલ	કલાર્ક	૦૨૬૫	૨૩૪૩૨૩૭	મો.૯૮૭૯૦ ૯૨૦૩૦	-	-	બ્લોક નં. ૧૨, નર્મદાનગર સોસા. નં. ૧, માંજલપુર, જાની પાર્કની બાજુમાં, વડોદરા
૧૭	શ્રી એ એમ વસાવા	કલાર્ક	૦૨૬૫	૨૩૧૨૮૨૦	મો.૯૮૯૮૬ ૯૬૯૦૮	-	vasavaa rvind23 @gmail. com	૧૩૬-૧૩૭, રાજકૃપા સોસા. ઈટોલા સ્ટેશન તા.જી. વડોદરા
૧૮	શ્રી કે વી ચાવડા	કલાર્ક	૦૨૬૫	૨૩૧૨૮૨૦	મો.૯૭૨૬૭ ૩૭૨૫૦	-	-	૨૮-એ, સત્યમ સોસા, સુભાનપુરા, વડોદરા-૨૩
૧૯	શ્રી આર એમ પ્રજાપતિ	કલાર્ક	૦૨૬૫	૨૩૧૨૮૨૦	મો.૯૭૨૬૩ ૩૭૩૬૯	-	-	ઘર નં.ડી-૧૩૬ ગોવિંદપાર્ક સોસાયટી દેસાઈપાર્કની બાજુમાં પોર
૨૦	શ્રી ડી બી પુરોહિત	ડ્રાઈવર	૦૨૬૫	૨૩૧૨૮૨૦	મો.૯૭૨૫૦ ૧૩૯૩૨	-	-	શ્રી રામનિવાસ, કડવા શેરી, ગોત્રી, વડોદરા
૨૧	શ્રી એ. જી વસાવા	ડ્રાઈવર	૦૨૬૫	૨૩૧૨૮૨૦	મો.૯૮૯૮૩ ૬૮૮૦૨	-	-	ડી-૩૬, અક્ષર વિહાર સોસાયટી, તરસાલી બાયપાસ નેશનલ હાઈવે-૮, તરસાલી, વડોદરા-૧૧
૨૨	શ્રી એન એમ દેશભ્રતાર	ડ્રાઈવર	૦૨૬૫	૨૩૧૨૮૨૦	મો.નં. ૯૯૮૦૮ ૪૩૬૯૯	-	-	મંગલપ્રસાદ ભવારીની ચાલ, ડી એસ ઓફીસ પાછળ, પ્રતાપનગર, વડોદરા
૨૩	શ્રી જે પી ગોહિલ	મેસે. કમ હેલ્પર	૦૨૬૫	૨૩૧૨૮૨૦	મો.૯૦૮૮૦ ૨૩૧૪૩	-	-	૮૨, ઘરમપુરા, હરીનગર પાછળ, ગોત્રી રોડ, વડોદરા

૨૪	શ્રી એસ એમ સોલંકી	મેસે. કમ હેલ્પર	૦૨૬૫	૨૩૧૨૮૨૦	મો. ૯૯૨૫૯ ૨૮૨૦૨	—	—	ઈટોલીપુરા પો.ગાંગડીયા તા.સાવલી જી.વડોદરા
૨૫	શ્રી વી એમ સોલંકી	મેસે. કમ હેલ્પર	૦૨૬૫	૨૩૧૨૮૨૦	મો. ૮૯૮૦૨૯ ૪૨૬૨	—	—	ગુ.હા.બોર્ડ અમ'ત નગર, મંજાલપાર્ક પાસે, લક્ષ્મીપુરા રોડ, વડોદરા
૨૬	શ્રી એન બી વણકર	મેસે. કમ હેલ્પર	૦૨૬૫	૨૩૧૨૮૨૦	મો. ૮૪૬૯૨ ૨૦૪૨૭ ૬૩૫૧૮ ૧૨૯૨૩	—	—	બી-૧૧૦, રેવાપાર્ક સો. આશીષપાર્ક નજીક, તરસાલી, વડોદરા
૨૭	શ્રી એમ એ જાદવ	મેસે. કમ હેલ્પર	૦૨૬૫	૨૩૧૨૮૨૦	મો. ૭૫૬૭૮ ૬૮૩૫૫	—	—	વાડીયા વગો, પ્રવીણસિંહના મકાનમાં, અનગઢ, તા.જી.વડોદરા
૨૮	શ્રી બી. કે. નિઝામા	પટાવાળા	૦૨૬૫	૨૩૧૨૮૨૦	મો. ૯૯૦૪૦ ૭૫૩૧૫	—	—	શ્યામ મંદિરની પાછળ, સિંધરોટ, નિઝામપુરા તા. જી.વડોદરા
૨૯	શ્રી એમ એસ દરબાર	એટેન્ડન્ટ	—	—	મો. ૯૮૯૮૭ ૦૨૯૨૪	—	—	મુ.પો. ફાજલપુર (સાંકરદા) તા.જી. વડોદરાજી. વડોદરા ઠે.ગુ.રી. રોડ, ૩૩૧, ખેતર વિસ્તાર ૩૯૧૩૪૦
૩૦	શ્રી એન સી પંડ્યા	હેલ્પર	૦૨૬૫	૨૮૩૦૦૨૫	મો. ૯૯૭૯૨ ૩૪૧૩૨	—	—	બીબી-૧, નારણનગર સોસાયટી મહેશ કોમ્પલેક્ષ, વાઘોડીયારોડ, યોગી સોસા. સામે, વડોદરા
૩૧	શ્રી સુષ્ટી પી કાશીવાલા	જુ. એકા. આસી કરારધારિત	૦૨૬૫	૨૩૧૨૮૨૦	મો. ૭૪૮૬૮૭ ૪૧૧૮	—	—	બી.૯૬ આધાર સોસા. નાલંદા પાણીની ટાંકી પાછળ, વાઘોડીયા રોડ, વડોદરા

૧. ધનવંતરી એકમ :

ક્રમ	નામ	હોદ્દો	એસટીડી કોડ નં.	ફોન નંબર		ફેક્સ	ઈ- મેઈલ	સરનામું
				કચેરી	ઘર			
૧	શ્રી જે. કે. બારીયા	પટાવાળા	૦૨૬૫	૨૮૩૦૦૨૫	૬૩૫૧૦ ૯૪૮૧૧	—		ગુ.રા.વ.વિ.નિ. વિ. પોર રમણગામડી જી.વડોદરા

૨. હિંમતનગર ડીવીઝન :

ક્રમ	નામ	હોદ્દો	એસ.ટી. ડી.કોડ	ફોન નંબર		ફેક્સ	ઈ-મેઈલ	સરનામું
				કચેરી	ઘર			
૧	ડૉ.બ્રિજેશ ડી ચૌધરી	નાયબ વન સંરક્ષક સીની. મેનેજર	૦૨૭૭૨	૨૪૧૭૧૬	૭૫૭૪૯ ૫૦૪૬૫	-	-	ઈ-૧૦૪, તિરૂપતિ ગ્રીન્ડ, ગાયત્રીમંદિર રોડ, જી.ઈ.બી. પાસે વિસનગર રોડ, મુ.તા. જી.મહેસાણા
૨	શ્રી એન. આર. નાયક	પટાવાળા હિંમતનગર	૦૨૭૭૨	૨૪૧૭૧૬	મો. ૮૨૩૮૯ ૨૪૦૫૭	-	narayan.nayak@gsfdcltd.co.in	મુ.તા. હિંમતનગર સિધ્ધાર્થનગર સોસાયટી, મહેતાપુરા, હિંમતનગર જી. સાબરકાંઠા.

૩. ગોધરા ડીવીઝન :

ક્રમ	નામ	હોદ્દો	એસ.ટી. ડી.કોડ	ફોન નંબર		ફેક્સ	ઈ-મેઈલ	સરનામું
				કચેરી	ઘર			
૧.	શ્રી બી.એમ.રાઠવા	જુની.એકા. આસી., ગોધરા	૦૨૬૭૨	૨૬૧૪૪૮	૯૭૨૩૯ ૯૨૦૭૨	-		મુ.કોલીયારી પો.વાઘવા તા.જેતપુર-પાવી જી.છોટાઉદેપુર

૪. બારીયા ડીવીઝન :

ક્રમ	નામ	હોદ્દો	એસ.ટી. કોડ નં.	ફોન નંબર		ફેક્સ	ઈ-મેઈલ	સરનામું
				કચેરી	ઘર			
૧.								

૫. છોટાઉદેપુર ડીવીઝન :

ક્રમ	નામ	હોદ્દો	એસ.ટી. કોડ નં.	ફોન નંબર		ફેક્સ	ઈ-મેઈલ	સરનામું
				કચેરી	ઘર			
૧.	શ્રી એસ. યુ. રાઠવા	જુની.એકા. આસી.	૦૨૬૬૯	૨૩૨૧૦૩	મો. ૯૯૭૮ ૪૧૨૫૫૩	-	-	જુના ટીવી રીલે કેન્દ્ર, જીવનભાઈના મકાનમાં, મુ.પા.જી.છોટાઉદેપુર
૨.	શ્રી એમ.એચ. પઠાણ	આસી. પ્રોજેક્ટ સુપરવાઈઝર, ગોધરા	૨૬૭૮	૨૨૧૭૧	મો. ૯૯૨૪૪ ૯૯૧૪૯	-		તાહેરી મંજીલ, કસ્બા કાજીવાડ, દાહોદ

૬. રાજપીપળા ડીવીઝન :

ક્રમ	નામ	હોદ્દો	એસ.ટી. કોડ નં.	ફોન નંબર		ફેક્સ	ઈ-મેઈલ	સરનામું
				કચેરી	ઘર			
૧.	શ્રી ડી. આર.ભટ્ટ	આસી. સુપરવાઈઝર	૦૨૬૪	૨૨૦૦૯૮	મો. ૯૯૨૪૬ ૫૦૬૭૦	-	-	મુ.પો. દ્રારકા, જી.દેવભુમિ ધ્વારકા, ખારવા દરવાજાની અંદર, દ્રારકા
૨	શ્રી વી. એમ. કોલી	જુની. એકા. આસી.	૦૨૬૪૦	૨૨૦૦૯૮	મો. ૯૯૭૯૨ ૧૫૨૯૦	-	-	મુ.પો. કરાલી, તા. પાવી-જેતપુર, જી.છોટાઉદેપુર

૭. વાંસદા ડીવીઝન :

ક્રમ	નામ	હોદ્દો	એસ.ટી.ડી. કોડ નં.	ફોન નંબર		ફેક્સ	ઈ-મેઈલ	સરનામું
				કચેરી	ઘર			

૮. ભુજ ડીવીઝન :

ક્રમ	નામ	હોદ્દો	એસ.ટી.ડી. કોડ નં.	ફોન નંબર		ફેક્સ	ઈ-મેઈલ	સરનામું
				કચેરી	ઘર			
૧.	શ્રી એ.જે.જેઠવા	આસી.સુપરવા ઈઝર	૦૨૮૩૨	૨૨૧૫૦૧	૯૮૭૯૦૧૨ ૫૯૭	૨૨૧૫૦ ૧	gsfdbc huj@yahoo. com	ઉમિયા સોસાયટી, નખત્રાણા

૯. ગાંધીનગર કચેરી :

ક્રમ	નામ	હોદ્દો	એસ.ટી.ડી. કોડ નં.	ફોન નંબર		ફેક્સ	ઈ-મેઈલ	સરનામું
				કચેરી	ઘર			
૧	ડૉ.બ્રિજેશ ડી ચૌધરી	ઈચા. સબ.ડીવી. મેનેજર, ગાંધીનગર	૦૭૯	૨૭૫૪૧૭૩૧	૭૫૭૪૯ ૫૦૪૬૫	-	dmgsfdcltd@gmail.com	ઈ-૧૦૪, તિરૂપતિ ગ્રીન્ઝ, ગાયત્રીમંદિર રોડ, જી.ઈ.બી. પાસે વિસનગર રોડ, મુ.તા.જી.મહેસાણા

૧૦. વનિલ ઉદ્યોગ :

ક્રમ	નામ	હોદ્દો	એસ.ટી.ડી. કોડ નં.	ફોન નંબર		ફેક્સ	ઈ-મેઈલ	સરનામું
				કચેરી	ઘર			
૧.	શ્રી એમ આર પટેલ,	ઈચા.વર્કસ મેનેજર વનિલ ઉદ્યોગ	૦૨૬૩૦	૨૩૦૦૨૦	મો.નં.૯૮૨ ૫૯ ૭૩૯૮૫	૨૩૫૫૨૯ ૩	vanilnavtad@yahoo.co.in	એ-૧૫૫, પુષ્પક ટાઉનશીપ, રીલાયન્સ સ્ટેડીયમનીસામે ઉડેરા, વડોદરા
૨	શ્રી એચ.એમ.વસાવા	ડે.પ્લાન્ટ ઈજનેર		૨૩૦૦૨૦	-	૯૯૭૯૩ ૪૨૯૯૯	harish60@gmail.com	મુ.વડોદરા, કમલાનગર કોમ્પ્લેક્સ, આદર્શ સોસાયટી
૩	શ્રી એમ એમ પટેલ	સર્વેયર	-	-	૯૯૭૯૦ ૨૩૨૯૧	-	mmpatel164@gmail.com	મુ.ડુંગરી શિવશક્તિ સોસાયટી, જેસપોર રોડ, તા.જી.વલસાડ
૪	શ્રી એસ. બી. પટેલ	હેલ્પર	૦૨૬૩૦	૨૩૦૦૨૨	૯૯૭૯૬ ૯૦૬૯૯	-	sureshpate12663@gmail.com	ડેરી ફળીયું, મુ.પો.નવતાડ, તા. વાંસદા, જી. નવસારી
૫	કુ.એમ.કે.કેવટ	એટેન્ડેન્ટ	૦૨૬૩૦	-	૭૯૭૪૫ ૯૯૧૯૧	-	kevatminaxi05269@gmail.com	મુ.પો.સુભાષચોક, મસ્જિદની ગલીમાં, બીલીમોરા, તા.ગણદેવી જી.નવસારી

૧૧. પાનમ પ્રોજેક્ટ :

ક્રમ	નામ	હોદ્દો	એસ.ટી.ડી. કોડ નં.	ફોન નંબર		ફેક્સ	ઈ- મેઈલ	સરનામું
				કચેરી	ઘર			
૧.	સુશ્રી ઉષ્મા દિનેશકુમાર નાણાવટી	નાયબ વન સંરક્ષક, પાનમ ગોધરા	૦૨૬૭૨	૨૬૧૪૪૮	૭૫૭૪૮૫ ૦૩૬૧	૦૨૭૭ ૨૨૬ ૧૪૪ ૯	dcfpa nam @gm aol.c om	નાયબ વન સંરક્ષક વિભાગ, ગોધરા ગુ.રા.વ.નિ.લિ. કોલાયરી નર્સરી, પંચમહાલ ડેરીની સામે, લુણાવાડા ગોધરા જી. પંચમહાલ
૨	શ્રી આઈ પી બારીયા	હિસાબનીશ	૦૨૬૭૨	૨૬૧૪૪૮	૯૯૭૯૧૯૦ ૪૬૧	—	—	ડી-૪૦ ઉમા સોસાયટી કંજરીરોડ, હાલોલ
૩	શ્રી જે વી ટંડેલ	રેંજ ફોરેસ્ટ ઓફિસર, શહેરા			૭૦૬૯૯ ૩૪૬૩૮			મુ.પો.ઉમરસાડી (માંગેલવાડ), તા.પારડી, જી.વલસાડ-૩૯૬૧૭૫
૪	શ્રી મતી જે એસ વસાવા	રેંજ ફોરેસ્ટ ઓફિસર, ગોધરા	—	—	૯૭૨૬૨ ૭૦૬૯૯	—	—	પ્રગતી નગર સોસા. નિવાહા, તા.ડેડીયાપાડા, જી.નર્મદા
૫	શ્રીમતી એસ એચ દવે	રેંજ ફોરેસ્ટ ઓફિસર, રતનપુર	—	—	૮૫૧૧૭ ૦૭૦૧૨	—	—	પ્લોટનં.૯ જલારામ સોસા.તલાજા રોડ, જુના જકાતનાકા, ભાવનગર-૩૬૪૦૦૧
૬	શ્રી જી કે સોલંકી	ફોરેસ્ટર, કરસાણા			૯૯૦૯૭ ૩૨૪૬૬			મુ.કરસાણા ફોરેસ્ટ કેમ્પસ પો.કરસાણા તા.ગોધરા જી.પંચહાલ
૭	શ્રી બી એમ પગી	ફોરેસ્ટર, સાદરા			૯૯૧૩૧ ૫૫૧૦૬			મુ.સાદરા ફોરેસ્ટ કેમ્પસ પો.તરસંગ તા.શહેરા જી.પંચહાલ
૮	શ્રી એન ડી ઝાલેયા	ફોરેસ્ટર, કબીરપુર	—	—	૯૯૭૪૬ ૧૭૧૫૧	—	—	મુ.કબીરપુર ફોરેસ્ટ કેમ્પસ પો.રેણા તા.શહેરા જી.પંચહાલ
૯	શ્રી જે પી બારીયા	ફોરેસ્ટર, ભુરખલ	—	—	૯૫૮૬૦ ૬૭૮૫૩	—	—	મુ.ભુરખલ ફોરેસ્ટ કેમ્પસ પો.રેણા તા.શહેરા જી.પંચમહાલ
૧૦	શ્રી મતી આર બી નિસરતા	ફોરેસ્ટર, ઘાણીત્રા	—	—	૭૮૫૯૮ ૭૨૭૨૪	—	—	મુ.ઘાણીત્રા ફોરેસ્ટ કેમ્પસ પો.ઘાણીત્રા તા.ગોધરા જી.પંચમહાલ
૧૧	શ્રી એ ટી માંગેલા	ફોરેસ્ટર, ઘાયકા	—	—	૮૧૪૧૪ ૮૦૬૯૧	—	—	મુ.ઘાયકા હાઈટેક નર્સરી ફોરેસ્ટ કેમ્પસ પો.રેણા.તા.શહેરા જી.પંચમહાલ
૧૨	શ્રી એસ એમ પટેલ	બીટગાર્ડ, ઈસરવાડી	—	—	૮૧૬૦૪ ૦૬૯૯૩	—	—	મુ.ઈસરવાડી ફોરેસ્ટ કેમ્પસ પો.રેણા તા.શહેરા જી.પંચમહાલ
૧૩	શ્રી જી એસ બારીયા	બીટગાર્ડ, કાલેસરી			૯૯૦૯૩ ૪૩૨૮૪			મુ.કાલેસરી ફોરેસ્ટ કેમ્પલ પો.રેણા તા.શહેરા જી.પંચમહાલ

૧૨ જુનાગઢ :

ક્રમ	નામ	હોદ્દો	એસ.ટી.ડી. કોડ નં.	ફોન નંબર		ફેક્સ	ઈ- મેઈલ	સરનામું
				કચેરી	ઘર			
૧.	શ્રી જલ્પેશ.એન.દવે	ઈન્ચાર્જ સબ ડીવી. મેનેજર, અને પ્રોડક્શન સુપરવાઈઝર	૦૨૮૫	૨૬૨૦ ૪૦૪	૯૪૨૭૭ ૭૩૮૬૦	૨૬૨૦ ૪૦૪	dave, hakoe sg198 7@gm ail.co m	ગુ.રા.વ.વિ.નિ.લિ. એ-૩૫/૩૬, 'સંવાદ કોમ્પલેક્ષ' લોઅર લેવલ, મહાનગર પાલિકા બિલ્ડીંગ, આઝાદચોક, જુનાગઢ
૨	કૌશીકકુમાર પી ડોબરીયા	કરારાધારિત આસી.સુપરવા ઈઝર	૦૨૮૫	૨૬૨૦ ૪૦૪	૭૦૪૬૭ ૬૨૬૬૧			Baagavatjpara, Mithividi, Kalavad (Shjtala) Jamnagar

પ્રકરણ-૧૧

નિગમના વિનિમયોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પદ્ધતિ સહિત તેના દરેક અધિકારી અને કર્મચારીને મળતું માસિક મહેનતાણું

૧. મુખ્ય કચેરી

ક્રમ	નામ	હોદ્દો	બેઝીક ગ્રેડપે (રૂ)
૧	શ્રી મહેશ સિંઘ, આઈએફએસ	મેનેજીંગ ડાયરેક્ટર	-
૨	શ્રી રામ રતન નાલા આઈએફએસ	ઈ.ચા.જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટર	-
૩	શ્રી એમ આર પટેલ	સીની. મેનેજર (માર્કેટીંગ)	૧,૩૦,૧૦૦/-
૪	શ્રી આર બી લિમ્બચીયા	કંપની સચિવ	૮૧,૧૦૦/-
૫	શ્રી પંકજ એચ જીમુલીયા	નાણાંકીય અંકુશક	૬૭,૭૦૦/-
૬	શ્રી અક્ષયકુમાર એન લિમ્બચીયા	સીની. પ્લાન્ટ ઈજનેર કરારાધારિત	૪૦,૦૦૦/-
૭	શ્રી જીગ્નેશ વસાવા	પ્લાન્ટ ઈજનેર કરારાધારિત	૨૭,૫૦૦/-
૮	શ્રી મુજાલ બી. શાહ	ડીવી. મેનેજર, એમએસપી કરારાધારિત	૩૦,૦૦૦/-
૯	શ્રી એમ ડી રાઠોડ	જુની. એકા. આસી.	૪૨,૨૦૦/-
૧૦	શ્રી એ કે પંડયા	જુની. એકા. આસી.	૪૩,૫૦૦/-
૧૧	શ્રી પી એસ શાહ	જુની. એકા. આસી.	૪૩,૫૦૦/-
૧૨	શ્રી સી જી. કોલયા	જુની. એકા. આસી.	૩૪,૩૦૦/-
૧૩	શ્રી એન. આર. શાહ	જુની. એકા. આસી.	૪૩,૫૦૦/-
૧૪	શ્રી આર સી વસાવા	સીનીયર કલાર્ક	૪૨,૨૦૦/-
૧૫	શ્રીમતી જે પી જાદવ	કલાર્ક	૪૩,૫૦૦/-
૧૬	શ્રીમતી બી પી પટેલ	કલાર્ક	૪૩,૫૦૦/-
૧૭	શ્રી એ એમ વસાવા	કલાર્ક	૪૩,૫૦૦/-
૧૮	શ્રી કે વી ચાવડા	કલાર્ક	૩૬,૪૦૦/-
૧૯	શ્રી આર એમ પ્રજાપતિ	કલાર્ક	૩૪,૩૦૦/-
૨૦	શ્રી ડી બી પુરોહિત	ડ્રાઈવર	૩૦,૫૦૦/-
૨૧	શ્રી એ. જી વસાવા	ડ્રાઈવર	૩૦,૫૦૦/-
૨૨	શ્રી એન એમ દેશભ્રતાર	ડ્રાઈવર	૩૦,૫૦૦/-
૨૩	શ્રી જે પી ગોહિલ	મેસે. કમ હેલ્પર	૩૨,૪૦૦/-
૨૪	શ્રી એસ એમ સોલંકી	મેસે. કમ હેલ્પર	૩૪,૪૦૦/-
૨૫	શ્રી વી એમ સોલંકી	મેસે. કમ હેલ્પર	૩૪,૪૦૦/-
૨૬	શ્રી એન બી વણકર	મેસે. કમ હેલ્પર	૩૨,૪૦૦/-
૨૭	શ્રી એમ એ જાદવ	મેસે. કમ હેલ્પર	૩૨,૦૦૦/-
૨૮	શ્રી બી. કે. નિઝામા	પટાવાળા	૨૫,૬૦૦/-
૨૯	શ્રી એમ એસ દરબાર	એટેન્ડન્ટ	૩૨,૦૦૦/-
૩૦	શ્રી એન સી પંડયા	હેલ્પર	૩૨,૦૦૦/-
૩૧	શ્રી સૃષ્ટી પી કાશીવાલા	જુ.એકા.આસી કરારાધારિત	૨૦,૦૦૦/-

૧. ધન્વંતરી એકમ :

ક્રમ	નામ	હોદ્દો	બેઝીક ગ્રેડપે (રૂ)
૧	શ્રી જે કે બારીયા	મેસે.કમ હેલ્પર	૨૫,૬૦૦/-

૨. હિંમતનગર ડીવીઝન :

ક્રમ	નામ	હોદ્દો	બેઝીક ગ્રેડપે (રૂ)
૧	ડૉ.બ્રિજેશ ડી ચૌધરી	નાયબ વન સંરક્ષક સીની. મેનેજર (હિંમતનગર)	૬૯,૭૦૦/---
૨	શ્રી એન. આર. નાયક	પટાવાળા ,હિંમતનગર	૩૦૨૦૦/-

૩. ગોધરા ડીવીઝન :

ક્રમ	નામ	હોદ્દો	બેઝીક ગ્રેડપે (રૂ)
૧.	શ્રી બી એમ રાઠવા	જુની.એકા.આસી	૪૨,૨૦૦/- લેવલ નં.-૪
કોલીયારી ડીવીઝન			
૧	-	-	-

૪. છોટાઉદેપુર ડીવીઝન :

ક્રમ	નામ	હોદ્દો	બેઝીક ગ્રેડપે (રૂ)
૧.	શ્રી એસ. યુ. રાઠવા	જુની.એકા.આસી.	૪૨૨૦૦/-
૨.	શ્રી એમ એચ પઠાણ	આસી. સુપરવાઈઝર, ગોધરા	૭૩૩૦/-

૫. રાજપીપળા ડીવીઝન :

ક્રમ	નામ	હોદ્દો	બેઝીક ગ્રેડપે (રૂ)
૧.	શ્રી ડી. આર. ભટ્ટ,	આસી.સુપરવાઈઝર	૩૯,૮૦૦/-
૨	શ્રી વી. એમ. કોલી	જુની. એકા. આસી.	૩૯,૮૦૦/-

૬. વાંસદા ડીવીઝન :

ક્રમ	નામ	હોદ્દો	બેઝીક ગ્રેડપે (રૂ)

૭. ભુજ ડીવીઝન :

ક્રમ	નામ	હોદ્દો	બેઝીક ગ્રેડપે (રૂ)
૧.	શ્રી એ.જે.જેઠવા	ઈ.ચા. ડીવી. મેનેજર,	૩૫,૪૦૦/- લેવલ નં.-૧

૮. ગાંધીનગર કચેરી :

ક્રમ	નામ	હોદ્દો	બેઝીક ગ્રેડપે (રૂ)
૧.	ડૉ.બ્રિજેશ ડી ચૌધરી	ઈ.ચા. સબ ડીવી.મેનેજર	૬૯,૭૦૦/—

૯. વનિલ ઉદ્યોગ :

ક્રમ	નામ	હોદ્દો	બેઝીક ગ્રેડપે (રૂ)
૧.	શ્રી એમ આર પટેલ	ઈચા.વર્કસ મેનેજર, વનિલ ઉદ્યોગ	૧,૩૦,૧૦૦/—
૨	શ્રી એચ એમ વસાવા	ડે.પ્લાન્ટ ઈજનેર	૪૪૯૦૦/— (લેવલ નં.૭)
૩	કુ. એમ.કે.કેવટ	એટેન્ડેન્ટ	૨૫૬૦૦/—
૪	શ્રી એસ. બી. પટેલ	હેલ્પર	૩૧૧૦૦

૧૦. પાનમ પ્રોજેક્ટ :

ક્રમ	નામ	હોદ્દો	બેઝીક ગ્રેડપે (રૂ)
૧.	સુશ્રી ઉષ્મા દિનેશકુમાર નાણાવટી	નાયબ વન સંરક્ષક, પાનમ ગોધરા	—૬૯,૭૦૦/— (સેલ-૨) (લેવલ નં. ૧૧)
૨	શ્રી આઈ પી બારીયા	હિસાબનીશ	૫૮૬૦૦/— (સેલ-૧૮) (લેવલ નં. ૬)
૩	શ્રી જે વી ટંડેલ	રેંજ ફોરેસ્ટ ઓફિસર, શહેરા	૪૨૩૦૦/— (સેલ-૩) (લેવલ નં. ૭)
૪	શ્રીમતી જે એસ વસાવા	રેંજ ફોરેસ્ટ ઓફિસર, ગોધરા	૪૧૧૦૦/— (સેલ-૨) (લેવલ નં. ૭)
૫	શ્રી એસ એચ દવે	રેંજ ફોરેસ્ટ ઓફિસર, રતનપુર	૪૧૧૦૦/— (સેલ-૨) (લેવલ નં. ૭)
૬	શ્રી જી કે સોલંકી	ફોરેસ્ટર, કરસાણા	૩૬૪૦૦/— (સેલ-૨) (લેવલ નં. ૪)
૭	શ્રી બી એમ પગી	ફોરેસ્ટર, સાદરા	૪૭૫૦૦/— (સેલ-૨૨) (લેવલ નં. ૪)
૮	શ્રી એન ડી ઝાલૈયા	ફોરેસ્ટર, કબીરપુર	૩૭૫૦૦/— (સેલ-૧૪) (લેવલ નં. ૪)
૯	શ્રી જે પી બારીયા	ફોરેસ્ટર, ભુરખલ	૨૬૩૦૦/— (સેલ-૨) (લેવલ નં. ૪)
૧૦	શ્રી મતી આર બી નિસરતા	ફોરેસ્ટર, ઘાણીત્રા	૨૬૩૦૦/— (સેલ-૨) (લેવલ નં. ૪)
૧૧	શ્રી એ ટી માંગેલા	ફોરેસ્ટર, ધાયકા	૨૭૯૦૦/— (સેલ-૪) (લેવલ નં. ૪)
૧૨	શ્રી એસ એમ પટેલ	બીટગાર્ડ, ઈસરવાડી	૨૧૫૦૦/— (સેલ-૭) (લેવલ નં. ૧)
૧૩	શ્રી જી એસ બારીયા	બીટગાર્ડ, કાલેસરી	૪૮૯૦૦/— (સેલ-૨૩) (લેવલ નં. ૪)

૧૧ જુનાગઢ :

ક્રમ	નામ	હોદ્દો	બેઝીક ગ્રેડપે (રૂ)
૧.	શ્રી જલ્પેશ.એન.દવે	ઈન્ચાર્જ સબ ડીવી. મેનેજર, અને પ્રોડક્શન સુપરવાઈઝર	૫૨,૦૦૦/-
૨	કૌશીકકુમાર પી ડોબરીયા	કરારાધારિત આસી.સુપરવાઈઝર	૧૫૦૦૦/-

નોંધ : વળતર/ વળતર ભથ્થુ તથા વિનિયમમાં જણાવ્યા મુજબ મહેનતાણું નક્કી કરવાની પદ્ધતિ સરકારશ્રીના નિયમો અનુસાર છે.

પ્રકરણ-૧૨

નિગમને ફાળવવામાં આવેલ અંદાજપત્ર
તમામ યોજનાઓ, સૂચિત ખર્ચ અને કરેલ ચુકવણી અંગે અહેવાલોની વિગતો
વિકાસ, નિર્માણ અને તકનિકી કાર્યો અંગે

૧૨.૧ જુદી જુદી યોજનાઓ અન્વયે જુદી જુદી પ્રવૃત્તિઓ માટે અંદાજપત્રની વિગતોની માહિતી -

ક્રમ	યોજનાનું નામ/ સદર	પ્રવૃત્તિ	પ્રવૃત્તિ શરૂ કર્યાની તારીખ	પ્રવૃત્તિના અંતની અંદાજેલ તારીખ	સૂચિત રકમ (રૂ.)	મંજૂર થયેલ રકમ (રૂ.)	છુટી કરેલ / ચૂકવેલ રકમ (હપ્તાની સંખ્યા) (રૂ.)	છેલ્લા વર્ષનું ખરેખર ખર્ચ (રૂ.)	કાર્યની ગુણવત્તા માટે સંપૂર્ણપણે કામગીરી માટે જવાબદાર અધિકારી
૧	૨	૩	૪	૫	૬	૭	૮	૯	૧૦
સને ૨૦૨૧-૨૨ માટે નિગમને કોઈપણ યોજના હેઠળ ગ્રાંટ ફાળવવામાં આવેલ નથી.									

પ્રકરણ—૧૩

સહાયકી કાર્યક્રમોના અમલ અંગેની પધ્ધતિ

૧૩.૧ નીચેના નમુના મુજબ માહિતી આપો.

- * કાર્યક્રમ/યોજનાનું નામ
- * કાર્યક્રમ/યોજનાનો સમયગાળો
- * કાર્યક્રમનો ઉદ્દેશ
- * કાર્યક્રમના ભૌતિક અને નાણાંકીય લક્ષ્યાંકો (છેલ્લા વર્ષ માટે)
- * લાભાર્થીની પાત્રતા
- * લાભ અંગેની પૂર્વ જરૂરિયાતો
- * કાર્યક્રમોનો લાભ લેવાની પધ્ધતિ
- * પાત્રતા નક્કી કરવા અંગેના માપદંડો
- * કાર્યક્રમમાં આપેલ લાભની વિગતો (સહાયકીની રકમ અથવા આપવામાં આવેલ અન્ય મદદ દર્શાવવી)
- * સહાયકી વિતરણની કાર્યપધ્ધતિ
- * અરજી ક્યાં કરવી કે અરજી કરવા માટે કચેરીમાં કોનો સંપર્ક કરવો
- * અરજી ફી (લાગુ પડતું હોય ત્યાં)
- * અન્ય ફી (લાગુ પડતું હોય ત્યાં)
- * અરજીપત્રકનો નમૂનો (લાગુ પડતું હોય તો જો સાદા કાગળ પર અરજી કરી હોય તો અરજીમાં શું શું દર્શાવવું તેનો ઉલ્લેખ કરો)
- * બિડાણોની યાદી (પ્રમાણપત્રો / દસ્તાવેજો)
- * બિડાણોનો નમૂનો
- * પ્રક્રિયાને લગતી સમસ્યાઓ અંગે ક્યાં સંપર્ક કરવો

નિગમ
ને
લાગુ
પડતું
નથી.

- * ઉપલબ્ધ નિધિની વિગતો (જીલ્લા કક્ષા, ઘટક કક્ષા વગેરે જેવા વિવિધ સ્થળોએ વડી કચેરી, ડીવીઝન વગેરે જેવાં વિવિધ સ્તરોએ)
- * નીચેના નમુનામાં લાભાર્થીઓની યાદી

ક્રમ નં./કોડ	લાભાર્થીનું નામ	સહાયકીની રકમ	માતા-પિતા વાલી	પસંદગીનો માપદંડ	સરનામું			
					જિલ્લો	શહેર	નગર/ગામ	ઘર નં.

પ્રકરણ-૧૪

નિગમે આપેલ છુટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારની વિગતો

કાર્યક્રમનું નામ

- * પ્રકાર (રાહત / પરમિટ / અધિકૃતિ)
- * ઉદ્દેશ
- * નકકી કરેલ લક્ષ્યાંક (છેલ્લા વર્ષ માટે)
- * પાત્રતા
- * પાત્રતા માટેના માપદંડો
- * પૂર્વ જરૂરિયાતો
- * લાભ મેળવવાની પદ્ધતિ
- * રાહત / પરમિટ / અધિકૃતિની સમય મર્યાદા
- * અરજી ફી
- * અરજીનો નમૂનો
- * બિડાણોની યાદી (પ્રમાણપત્રો / દસ્તાવેજો)
- * બિડાણોનો નમૂનો
- નીચે આપેલા નમૂનામાં લાભાર્થીની વિગતો

નિગમને
લાગુ
પડતુ
નથી.

ક્રમ નં./કોડ	લાભાર્થીનું નામ	કાયદેસરતાની મુદત	માતા-પિતા/ વાલી	સરનામું			
				જિલ્લો	શહેર	નગર/ગામ	ઘર નં.

રાહત માટે નીચેની માહિતી પણ આપવી

*	આપેલ લાભની વિગત	નિગમને લાગુ પડતુ નથી
*	લાભોનું વિતરણ	

પ્રકરણ—૧૫

વીજાણુરૂપે ઉપલબ્ધ માહિતી

વીજાણુરૂપે ઉપલબ્ધ વિવિધ યોજનાઓની માહિતીની વિગતો નીચે પ્રમાણે છે.

૧. ઈ-મેઈલ : gsfdcltd@gmail.com
૨. વેબસાઈટ : www.gsfdcltd.co.in

પ્રકરણ—૧.૬

માહિતી મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓ

લોકોને માહિતી મળે તે માટે નિગમે અપનાવેલ સાધનો, પધ્ધતિઓ અથવા સુવિધાઓ નીચે પ્રમાણે છે.

૧. વર્તમાનપત્રો
૨. પ્રદર્શનો
૩. નોટીસ બોર્ડ
૪. દસ્તાવેજોની નકલો મેળવવાની પધ્ધતિ
૫. નિગમની વેબસાઈટ
૬. જાહેરખબરના અન્ય સાધનો

પ્રકરણ-૧૭

જાહેર માહિતી અધિકારીઓના નામો, હોદ્દાઓ અને બીજી વિગતો

૧૭.૧ નિગમના મદદનીશ જાહેર માહિતી અધિકારીઓ, જાહેર માહિતી અધિકારી અને અપીલ સત્તાધિકારી વિશેની સંપર્ક માહિતી :

નિગમના મદદનીશ જાહેર માહિતી અધિકારીઓ, જાહેર માહિતી અધિકારી અને અપીલ સત્તાધિકારી વિશેની સંપર્ક માહિતી નીચે પ્રમાણે છે.

જાહેર માહિતી અધિકારી :

ક્રમ	નામ	હોદ્દો	એસટીડી કોડ	ફોન નંબર		ફેક્સ	ઈ-મેઈલ	સરનામું
				કચેરી	ઘર			
૧.	શ્રી એ. કે. પંડ્યા	ઈ.ચા.મેનેજર (વહીવટ)	૦૨૬૫	૨૩૪૪૮૫૨	મો.	૨૩૫૫૨૯૩	gsfdcltd@gmail.com	ગુ.રા.વ.વિ.નિ.લિ 'વનગંગા', ૭૮, અલકાપુરી, વડોદરા ૩૯૦૦૦૭

અપીલ સત્તાધિકારી :

ક્રમ	નામ	હોદ્દો	એસટીડી કોડ	ફોન નંબર		ફેક્સ	ઈ-મેઈલ	સરનામું
				કચેરી	ઘર			
૧.	શ્રી રાજેશ લિમ્બચીયા	કંપની સચિવ કમ સીનીયર મેનેજર (લીગલ એન્ડ પર્સોનેલ)	૦૨૬૫	૨૩૫૫૨૯૧	મો.૯૯૧૩૭૨૫૭૭૭	૨૩૫૫૨૯૩	gsfdcltd@gmail.com	ગુ.રા.વ.વિ.નિ.લિ. 'વનગંગા', ૭૮, અલકાપુરી, વડોદરા ૩૯૦૦૦૭

મદદનીશ જાહેર માહિતી અધિકારીઓ :

ક્રમ	નામ	હોદ્દો	એસ.ટી.ડી કોડ	ફોન નંબર		ફેક્સ	ઈ-મેઈલ	સરનામું
				કચેરી	ઘર			
૧.	શ્રી ડી. આર.ગોહીલ	સબ ડીવ.મેનેજર કરારા ધારિત	૦૨૬૬૯	૨૩૨૧૦૩	મો.૯૪૨૭૦૫૩૯૨૭	-	-	ગુ.રા.વ.વિ.નિ.લિ. ૪, વૃંદાવન સોસાયટી, છોટાઉદેપુર ૩૯૧૧૬૫ (જી.વડોદરા)
૨.	શ્રી ડી આર ભટ્ટ,	ઈ.ચા.સબ ડીવ.મેનેજર અને આસી.સુપર વાઈઝર	૦૨૬૪૦	૨૨૦૦૯૮	મો.૯૪૨૭૪૭૪૪૬૭	-	-	ગુ.રા.વ.વિ.નિ.લિ. પ્લોટ નં.૧૫, જી.આઈ.ડી.સી.એસ્ટેટ, પો.બો.નં.૧૭, રાજપીપળા ૩૯૩૧૪૫ (જી.નર્મદા)
૩.	શ્રી એચ.એમ.વસાવા	ઈ.ચા. સબ.ડીવી. મેનેજર વાંસદા	૦૨૬૩૦	૨૨૨૩૫૯	મો.૯૯૯૮૪૩૦૦૦૭	-	-	ગુ.રા.વ.વિ.નિ.લિ. રૂપકુંવરબા રોડ, પો.બો.નં.૧૪, વાંસદા-૩૯૬૫૮૦ (જી.નવસારી)

૪.	શ્રી એ.જે.જેઠવા	ઈ.ચા.સબ મેનેજર અને આસી.સુપર વાઈઝર ભુજ	૦૨૮૩૨	૨૨૧૫૦૧	મો.૯૬૮૭ ૮૨૩૪૬૧	૨૨૧૫૦૧	—	ગુ.રા.વ.વિ.નિ.લિ. ૨૦૨, ૧લો માળ, બહુમાળી ભવન, ભુજ-૩૭૦૦૦૧ (જી.કચ્છ)
૫.	શ્રી નિલેષ પંડયા	ઈ.ચા.વર્કસ મેનેજર વનિલ ઉદ્યોગ નવતાડ	૦૨૬૩૦	૨૩૦૦૨૨	મો.૯૯૯૯ ૪૩૦૦૦૭	૨૩૦૦૨૦	—	ગુ.રા.વ.વિ.નિ.લિ. વનિલ ઉદ્યોગ, નવતાડ-૩૯૬૫૮૦ તા.વાંસદા (જી.નવસારી)
૬.	સુશ્રી ઉષ્મા દિનેશકુમાર નાણાવટી	નાયબ વનસંરક્ષક, પાનમ, ગોધરા	૦૨૬૭૨	૨૬૧૪૪૯	મો.૯૯૨૫ ૦ ૫૦૧૭૩	—	—	૭૨-શાંતીનગર, શુભમ ટેનામેન્ટની બાજુમાં બામરોલી રોડ , ગોધરા
૭	શ્રી જલ્પેશ એન દવે	સબ ડીવી.મેનેજ ર, જુનાગઢ	૦૨૮૫	૨૬૨૦૪૦ ૪	૯૬૮૭૮ ૨૩૪૬૧	—	—	૨૬, અંબિકાધામ સોસાયટી મહાદેની મંદિરની બાજુમાં વસડર રોડ, વડોદરા
૮	ડૉ.બ્રિજેશ ડી ચૌધરી	સીની. મેનેજર હિંમતનગર	૦૨૭૭૨	૨૪૧૭૧૬	—	—	—	ગુ.રા.વ.વિ.નિ.લિ. ઘાણધા નર્સરી પાસે, ઈડર હાઈવે જી. સાબરકાંઠા , હિંમતનગર
૯	ડૉ.બ્રિજેશ ડી ચૌધરી	ઈ.ચા.સબ ડીવી. ગાંધીનગર	૦૭૯	૨૩૨૬૦૬ ૩૪	મો.૯૪૨૭ ૪૭૪૪૬૭	—	—	ગુ.રા.વ.વિ.નિ.લિ. બ્લોક નંબર-૧૯૮/૪ ગ-૧, સેક્ટર-૩૦, ગાંધીનગર-૩૮૨૦૧૦

પ્રકરણ-૧૮

અન્ય ઉપયોગી માહિતી

૧૮.૧ માહિતી મેળવવા અંગે :

૧. અરજી પત્રક :

આ અધિનિયમ અન્વયે માહિતી મેળવવા ઈચ્છતી કોઈપણ વ્યક્તિ નીચે જણાવેલ નમૂના પ્રમાણેના ફોર્મ-"ક" માં "જાહેર માહિતી અધિકારી" ને અરજી કરશે.

નમૂનો - ૬

(જુઓ નિયમ-૩(૧))

માહિતી મેળવવા માટેની અરજી

આઈ. ડી. ક્રમાંક

(કચેરીના ઉપયોગ માટે)

પ્રતિ,

જાહેર માહિતી અધિકારીશ્રી

ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લી.

"વનગંગા" ૭૮, અલકાપુરી

વડોદરા-૩૯૦૦૦૭

૧. અરજદારનું નામ :

૨. પૂરું સરનામું :

૩. જરૂરી માહિતીની વિગતો (ટૂંકમાં) :

૪. હું, આથી જણાવું છું કે, માંગવામાં આવેલી માહિતી, માહિતીના અધિકાર બાબતના અધિનિયમ, ૨૦૦૫ ની કલમ ૮ અથવા ૯ હેઠળ માહિતી જાહેર કરવામાંથી મુક્તિ આપેલી હોય તેવા વર્ગ હેઠળ આવરી લીધેલ નથી અને મારી ઉત્તમ જાણ મુજબ તે આપના વિભાગ / કચેરીને લગતી છે.

૫. * (૧) મેં કચેરીમાં તારીખ : ના રોજ પહોંચ્યું ક્રમાંક :
..... પ્રમાણે રૂ..... (શબ્દોમાં) રૂપિયા
..... ની ફી ચુકવેલી છે.

* (૨) હું આ સાથે ચુકવવાપાત્ર ફી પેટે ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લી. ની તરફેણમાં
બેંકે કાઢી આપેલ તારીખ : નો ડિમાન્ડ ડ્રાફ્ટ / પે ઓર્ડરનું બિડાણ કરું
છું.

* (૩) આ અરજી ઉપર રૂ. ની નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ ચોટાડેલ છે.

* (૪) હું ગરીબ રેખા હેઠળના કુટુંબની વ્યક્તિ છું. મારા રેશનકાર્ડ / પ્રમાણપત્રની ઝેરોક્ષ નકલ આ સાથે જોડી
છે.

સ્થળ :

તારીખ :

અરજદારની સહી

ઈ-મેઈલ એડ્રેસ, જો હોય તો,

ટેલીફોન. નં. (કચેરી) :

(નિવાસ) :

તા.ક. : ગરીબી રેખા હેઠળની વ્યક્તિએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેશે. નહિ.

* લાગુ પડતું ન હોય તે છેકી નાખવું.

જાહેર માહિતી અધિકારી ફોર્મ - "ક" માં મળેલ અરજીની યોગ્ય પહોંચ પાઠવશે.

૨. ફી :

માહિતી મેળવવા ઈચ્છતી વ્યક્તિ ફોર્મ - "ક" સાથે નિયત કરેલ દર મુજબની ફી જમા કરાવશે. પરંતુ વીજાણુ માધ્યમ મારફત અરજી કરનાર વ્યક્તિએ તેની માંગણીની તારીખથી ૭ દિવસમાં અધિકૃત વ્યક્તિ પાસે રોકડમાં ફી જમા કરાવવાની રહેશે, જેમાં ચૂક થતાં અરજદારે અરજી પાછી ખેંચી હોવાનું ગણવામાં આવશે.

જો કે સરકારશ્રીએ વ્યાખ્યાયિત કરેલી ગરીબી રેખા નીચે આવતી વ્યક્તિઓ પાસેથી કોઈ ફી વસુલવામાં આવશે નહીં.

નિગમ નીચે મુજબ નિયત કરેલ દરે ફી વસુલ કરશે.

(ક) અરજી ફી :

અરજી દીઠ રૂ.૨૦/-

(ખ) અન્ય ફી અને ચાર્જ :

- (૧) પ્રકાશનના સ્વરૂપમાં ઉપલબ્ધ હોય તેવી માહિતી માટે પ્રકાશનની ખરેખરી કિંમત
- (૨) બીજી માહિતી / દસ્તાવેજોની નકલ માટે પાના દીઠ રૂ.૨/-
- (૩) નમૂના (સેમ્પલ), મોડેલ અથવા ફોટોગ્રાફ માટે તેની ખરેખરી કિંમત જેટલી રકમ.
- (૪) રેકર્ડની તપાસણી માટે પ્રથમ અર્ધા કલાક માટે કોઈ ફી નહીં અને ત્યાર પછી દરેક અર્ધા કલાક માટે રૂ.૨૦/-
- (૫) શક્ય હોય ત્યાં ફલોપી અથવા ડિસ્કમાં પૂરી પાડવાની માહિતી માટે ફલોપી અથવા ડિસ્ક દીઠ રૂ.૫૦/-

૩. માહિતી આપવાનો ઈન્કાર કરવામાં આવે અથવા આપવામાં આવેલ માહિતીથી અરજદાર નારાજ હોય તેવા પ્રસંગે અપીલ કરવા અંગેની કાર્યવાહી :

જો

- (૧) અરજદારે તેમની અરજી જાહેર માહિતી અધિકારીને આપી હોય તો અરજી કર્યાની તારીખથી ૩૦ દિવસ સુધીમાં, અથવા
- (૨) અરજદારની અરજી અન્ય જાહેર સત્તામંડળને તબદીલ કરવામાં આવી હોય તો અરજી કર્યાની તારીખથી ૩૫ દિવસ સુધીમાં, અથવા
- (૩) અરજદારની અરજીમાં ત્રીજા પક્ષકારના હિત સમાયેલા હશે તો અરજી કર્યાની તારીખથી ૪૦ દિવસ સુધીમાં, અથવા
- (૪) અરજદારની અરજી વ્યક્તિની જીંદગી અને સ્વતંત્રતા સંબંધી માહિતી મેળવવા હશે તો અરજી કર્યાની તારીખથી ૪૮ કલાક સુધીમાં અરજદારને જવાબ ન મળે

અથવા

ઉક્ત (૧), (૨), (૩), (૪) માંની નિયત સમયમર્યાદામાં મળેલા જવાબથી અરજદાર નારાજ હોય તો

અરજદાર અપીલ માટે નિયત કરેલ ફી અધિકૃત વ્યક્તિ પાસે જમા કરાવીને ઉક્ત (૧), (૨), (૩), (૪) માંની નિયત સમયમર્યાદા પૂરી થયાની તારીખથી અથવા તેમની અરજીનો જવાબ મળ્યાની તારીખથી ૩૦ દિવસમાં અપીલ સત્તાધિકારીને (નિગમના વહીવટી નિયામકશ્રીને) નીચે જણાવેલ નમૂનાના ફોર્મ-"જ" માં પ્રથમ અપીલ રજુ કરી શકે છે.

નમૂનો જ

(જુઓ નિયમ ૬ (૧))

પ્રથમ અપીલ

આઈ.ડી.નંબર

તારીખ :

(કચેરીના ઉપયોગ માટે)

પ્રતિ

અપીલ સત્તાધિકારીશ્રી

ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિ.

"વનગંગા" ૭૮, અલકાપુરી

વડોદરા-૩૯૦૦૦૭

શ્રીમાન,

મને કોઈ નિર્ણય મળ્યો ન હોવાથી/ ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિ.ના જાહેર માહિતી અધિકારીના નિર્ણયથી નારાજ હોવાથી હું, આથી આ અપીલ દાખલ કરુ છું. મારી અરજીની વિગતો નીચે પ્રમાણે છે :-

૧. અપીલ કરનારનું નામ :

૨. અપીલ કરનારનું સરનામું :

૩. (ક) જાહેર માહિતી અધિકારીનું નામ :
જાહેર માહિતી અધિકારીનું સરનામું :

(ખ) કચેરી અને સરનામું :

(ગ) જે નિર્ણયની સામે અપીલ કરી હોય તે નિર્ણયના ક્રમાંક અને તારીખ સહિત એવા નિર્ણયની વિગતો

૪. નમૂના ક માં રજૂ કરેલી અરજીની તારીખ :

૫. માહિતીની વિગતો :

(૧) માંગવામાં આવેલ માહિતી :

(૨) જેના માટે માહિતી માંગવામાં આવતી હોય તેનો સમયગાળો.

૬. નમૂના ક માં અરજી સાદર કર્યા પછી ત્રીસ દિવસ પૂરા થતા હોય તે તારીખ.

૭. અપીલ માટેના કારણો-

(ક) નમૂના ક માં અરજી સાદર કર્યાના ૩૦ દિવસની અંદર કોઈ નિર્ણય મળેલ નથી.

(ખ) જાહેર માહિતી અધિકારીના તા. ના રોજના નિર્ણયથી નારાજ હોવાથી.

(લાગુ ન પડતુ હોય તે કારણ છેકી નાખો.)

૮. અપીલ માટેનું કારણ, કેસની સંક્ષિપ્ત હકીકતો.

૯. અપીલ દાખલ કરવા માટેની છેલ્લી તારીખ :

૧૦. જેના માટે વિનંતી કરી હોય / દાદ માંગવામાં આવી હોય તે માહિતી :

હું આથી જણાવું છું કે ઉપર આપવામાં આવેલી માહિતી અને વિગતો મારી ઉત્તમ જાણ અને માન્યતા મુજબ સાચી છે.

સ્થળ :

તારીખ :

અપીલ કરનારનું નામ :

અપીલ કરનારની સહી :

તેનું કોઈ ઈ-મેઈલ એડ્રેસ હોય તો તે:

ટેલીફોન નંબર(ઓ)

ટેલીફોન નંબર(નિવાસ)

----- અહીંથી કાપવું -----

સ્વીકૃતિ પહોંચ

જાહેર માહિતી અધિકારી

ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિ.

વડોદરા

તરફથી

આઈ.ડી.નંબર :

તારીખ :

(૧) આથી, શ્રી રહેવાસી તરફથી ગુજરાત માહિતી મેળવવા બાબતના નિયમો, ૨૦૦૫ના નિયમ ૬ના પેટા-નિયમ(૧) હેઠળ ઠરાવેલા નમૂના જ માં અપીલ અરજી મળી છે.

અરજી મેળવનાર કારકૂનની સહી :

અપીલ સત્તાધિકારીની કચેરી :

ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિ., વડોદરા

ટેલીફોન નં. (૦૨૬૫) ૨૩૫૫૨૯૧

ઈ-મેઈલ : gsgfdcltd@gmail.com

વેબસાઈટ : www.gsgfdcltd.co.in